

Paigaam

IMWS

Issue 319 October 2019 Saffar 1440

IMWS & Rabetah Remembers

On Sunday 15 September 2019, an event was held at the Al Hikmah Centre to discuss the life and recognise and reflect upon the contributions and legacy of Hazrat Mawlana Yusuf Motala sahib (rahmatullahi alaih). Despite the programme being planned and delivered on short notice, the large number of attendees was testimony to the impact Hazrat has had on Muslims in general, and more specifically upon residents of Batley through his lifetime.

Continued on page 5



A Special Tribute to Shaykh Al-Hadith Mawlana Yusuf Motala

By Mawlana Khalil Ahmed Kazi

The sudden demise of Shaykh Al-Hadith Mawlana Yusuf Motala Şahib on Sunday 8 September was the cause of great sadness and shock for Muslims across the world and especially those living in the United Kingdom. The Shaykh had travelled to Canada, a few days after Eidul Adhaa, with his family to deliver some Hadith lectures and programmes. During his stay, he suffered a heart attack and remained in a state of coma until he passed away.

The Shaykh was a great Scholar and visionary whose contribution and legacy in the field of education and Dawah for Muslims living in the Western world remains unmatched. The Shaykh was surely from amongst those great saints and learned scholars whose existence is scarce these days and whose numbers are rapidly declining. Once they depart, no replacement can be found. Each departure heralds the final hour. In the words of the Prophet Muhammad

“Verily, Allah will not seize sacred knowledge by extracting it from the people, but will seize it by removing the scholars. Until, when no scholars will remain, people will appoint ignorant men as leaders. When questioned, they will pass rulings without knowledge. Thus, they will be misguided and will lead others astray.” (Sahih Al-Bukhari)

Continued on page 6



Des Chef
CATERING
WE CATER FOR ALL EVENTS

TEL: 01924 475169

Near M. J. Aziz Park & Co. Ltd

2 PURWELL LANE, BATLEY WF17 5BH OPENING TIMES MON - SUN 11AM - 10:30PM | TUE 4PM - 10:30PM



OFFER ANY 2 X 12" PIZZAS
WITH FRIES FOR £12
Excludes extras and delivery

DESI SPECIAL

BEST CHICKEN DONNER IN TOWN

Freshly prepared in house (breast),
marinated in desi spices and sauces
Served in a bun



See website
for full details
of our catering

Beautifully Crafted Fireplace Manufacturers



Qasim specialises in manufacturing of marble, limestone and granite fireplaces. Situated in the heart of West Yorkshire, Qasim also designs and manufactures kitchen worktops only using the finest quality materials.

Choosing the right fireplace design, material and finish are all part of our service. We only source the best materials worldwide offering also competitive prices.

Every fireplace we make is individually made by skilled craftsmen. We only use experienced stone masons and the very latest precision machinery. Qasim Marble Fireplace and Kitchen Manufacturer has a large manufacturing facility to ensure a fast and high quality service.

Qasim International Ltd
Open 7 Days 9am – 5pm

23/25 Branch Road, Batley,
West Yorkshire, WF17 5HY

Telephone: 01924 422096
Fax: 01924 477851

E-mail: info@qasiminternational.co.uk
Website: www.qasiminternational.co.uk

Dewsbury
AUTO BODYCRAFT
MOT CENTRE

We have full body-shop facilities
Non-Fault Accident Management

Bodywork
Custom Styling
Alloy Wheels Refurb
Replacement vehicles provided
MOs
Servicing
Brakes
Exhaust

M 07800 500 473
T 01924 650 305

162 BRADFORD ROAD
DEWSBURY, WF13 2HA

www.dewsburyautobodycraft.co.uk

Employment opportunity
Experienced
BODYWORKER REQUIRED

With experience of prepping, priming etc - must be time served
Experience of painting will be of an advantage
To work for an independent garage
Permanent- long term job
In Dewsbury
Where you will be a part of a small and friendly team

Ring now for immediate start
07523 146558

Al-Hikmah Centre

28 Track Road, Batley, West Yorkshire, WF17 7AA

OFFICE SPACE TO-LET

- SAFE SECURE OFFICE SETTING
- CLIENT CAR PARKING FACILITY
- EASY ACCESS / CONVENIENT LOCATION
- SCENIC SURROUNDINGS

CONTACT US FOR MORE DETAILS AND VIEWING

CALL RENT FREE and WiFi

Call: 01924 500 555
or email: info@imws.org.uk

Mileusnic Chemist

FREE Prescription Collection & Delivery

FREE diabetes machines to give away - whilst stocks last

IMPROVING YOUR HEALTH

Proprietors: Mr Riyaz Patel / Mr Farooq Patel
133 Upper Commercial St, Batley WF17 5DH

01924 441434

تمارا میڈیسنل سہولتی سہ
آپ کے نسخوں کی جمع کرنے اور
آپ کے گھر پر پہنچانے کی سہولت

SC Caterers

www.sukkuroulsino.co.uk

CATERING FOR PARTIES • WEDDINGS • CONFERENCES • FUNCTIONS ANY OCCASION

01924 485 786
07976 266438 / 07974 162929 / 07894 728204
Unit 5, Bridge Industrial Estate, Mill Street East, Dewsbury WF12 9BQ

Elegant Curtains & Blinds
Affordable Elegance

Made to Measure Curtains & Blinds

Specialists in Motorised and Vision Blinds

Visit our NEW showroom on
86 Bradford Road, Dewsbury, WF13 2EF

Call us on 01924 724848

www.elegantcurtainsandblinds.co.uk

FREE EYE TEST
with spectacle purchase

OPTICIANS | OPTICAL LAB | GLASSES IN 1HR

2 FOR 1 FROM £60

Top Quality Frames Free on NHS
Designer brands
KIDS GO FREE
1 in 5 children have an undiagnosed eye condition
So don't delay - Register today

Contact lenses Save £££'s Free trial

5 Oxford Street, Batley, WF17 7PZ, (01924) 455577

A1 FOOD PRODUCTS

Taking Care of All Your Weddings, Parties and Engagement Requirements With

FRESHLY MADE TANDOORI NAANS

Orders to be placed 24 Hours in advance Minimum Order Required

Contact Nazir Masryar
01924 458000 / 07713 637136

At the Junction of the Ring Road & Saroswathy Pastry

A1 Food Products, Providence Works, Henry Street, Batley Carr. 1 Dotted for Post Office

www.a1foodproducts.co.uk

MADE TO ORDER. PLEASE CONTACT US FOR A FREE NO OBLIGATION CONSULTATION

C2K
RESPECT - UPHOLDING
WORLD'S TRADITIONAL METHODS

New sofas and corner sofas made to measure. It's upholstering wingchairs, dining chairs, etc. It's been in force pulled to better than new line, repairing cushions, broken springs, rips and tears

t: 07748845911 e: info@c2kupholstery.com

BATLEY
SCHOOL OF MOTORING Est. 1967


EXPERIENCED DSA Approved Driving Instructors providing quality lessons tailored to suit the individual

Visit our website and read what our students have to say

www.bsom1967.co.uk
info@bsom1967.co.uk

call 07812 160 276 or 01924 5000 64

Conference Facilities at the Al-Hikmah Centre



Training Seminars

Conference Halls

Meeting Rooms

Workshops

Functions

Events

for more information call:

01924 500 555

or email info@imws.org.uk

imws

Al-Hikmah Centre, 28 Track Road, Batley. WF17 7AA

IMWS and Rabetah Ulema in Batley held a joint programme on 14th September “Islam, Marriage and SRE Curriculum”.

The first speaker at the event held at the Al Hikmah centre on 14th September was, Mufti Amjad Muhammad from Bradford who spoke initially about “Navigating Human Identity in the 21st century”.

Mufti Saheb is an academic in this field and has carried out extensive research. He discussed the various social constructs in today’s society around sex and gender. Mufti Saheb also spoke on the importance and benefits of Islamic schools which can provide a holistic approach.

The second speaker was Brother Soyeb Yusuf from Dewsbury, he highlighted the key milestones in the timeline for Sex and Relationship Education (SRE) and how certain changes will be made from September 2020. He also spoke on the importance of parental engagement with schools in a positive manner. Parental and community consultation is mandatory on schools and parents should therefore see this as their responsibility to arrange

a meeting with the school and ask relevant questions and provide their input.

After Maghrib, Mufti Muhammad Ibn Adam Al Kawthari from Leicester addressed the gathering to talk about the importance of marriage. He highlighted the growing need to help and facilitate marriage for young people at an appropriate age and not to delay marriage to satisfy “customs and traditions” which seem to be getting out of hand at the moment.

The final speaker was Maulana Dr Rafaqat from Bradford discussing the topic of sexual health/ social harm and it’s impact on society. He gave a powerpoint presentation to highlight the various findings that he discussed.

IMWS and Rabetah would like to thank all the speakers and attendees for their time and demonstrating their concerns for the wellbeing of our children and future generations.

Inside this issue

IMWS & Rabetah joint programme.....page 5

A special Tribute to Shaykh Al-Hadith Mawlana Yusuf Motalapage 06

IMWS & Rabetah Remembers Sunday programme.....page 08

Gaza Feedback report....page 09

The Batley Gala.....page 10

The Legal Slot.....page 11

Your MP say, Paula Sheriff MPpage 11

We’re back.....page 12

Batley Ninjaspage 13

Mount Cricket Club.....page 14

Common Coldpage 15

Eight Practical tips for healthy eating.....page 19

Gujarati.....page 22-25

Urdupage 26-27



01924 500 555



paigaam@imws.org.uk



imws.org.uk



@paigaam2



paigaam publications



Sports Hall 07968 222 886

A Special Tribute to Shaykh Al-Hadith Mawlana Yusuf Motala

(May the Mercy of Almighty be upon him)
(1946-2019) By Mawlana Khalil Ahmed Kazi

Continued from page 1

Name & Birth

The Shaykh's full name was, Yusuf son of Sulayman son of Qasim. The family surname was Motala. He was born on 25 November 1946 in the village of Nani Naroli, Gujarat, India.

Early Education

The Shaykh initiated his education in his home village at Madrasah Targeeb al-Qur'an, where he also learnt the Urdu language and completed the memorisation of the Holy Qur'an.

In 1965, he enrolled at Jamia Husayniyyah, Rander, Gujarat where he initiated the Alim course until the completion of the Hidayah year.

Advanced Education

In 1965, he enrolled at the world famous Islamic seminary Madrasah Mazahir Uloom, Saharanpur, where he completed his final two years of the Alim course and graduated. It was at this institute that the Shaykh established a very close relationship with his teacher Shaykh al-Hadith Mawlana Muhammad Zakariyya Kandhelwi (d. 1982) who became his guide and mentor.

Distinguished Teachers

The following are some of the distinguished teachers the Shaykh studied during his stay

at Madrasah Mazahir Uloom.

Shaykh al-Hadith Mawlana Muhammad Zakariyya Kandhelwi (d. 1982)

Mawlana As'adullah Rampuri (d. 1979)

Mufti Muzaffar Husayn (d. 2003)

Shaykh al-Hadith Mawlana Muhammad Yunus Jownpuri (d. 2017)

Mufti Muhammad Yahya (d. 1996)

Migration to the UK

In 1968, the Shaykh travelled to the UK for marriage. After some months of residence in the UK, the Shaykh was appointed as an Imam at Zakariyya Jame Masjid in Bolton.

Establishment of the First Islamic Seminary in UK

In 1973, the Shaykh with the advice and guidance of his mentor Shaykh al-Hadith Mawlana Muhammad Zakariyya Kandhelwi purchased a former hospital in Ramsbottom, Bury to establish the first Islamic Seminary in the UK, named Darul Uloom Al-Arabiyyah Al-Islamiyyah, commonly known as Darul Uloom Bury.

First visit of Shaykh al-Hadith Mawlana Muhammad Zakariyya Kandhelwi to UK

Upon the invitation of the Shaykh, the leading Muslim authority of the era and Master of Hadith, Shaykh al-Hadith

Mawlana Muhammad Zakariyya Kandhelwi visited the UK on 24 June 1979, for very first time and stayed at Darul Uloom Bury for five days. It was during this visit that the very first lesson from the Hadith book, Mishkaat al-Masabeeh was taught by Shaykh al-Hadith Mawlana Muhammad Zakariyya Kandhelwi to the students at Darul Uloom Bury.

First Graduates from Darul Uloom Bury

On 25 August 1981, Shaykh al-Hadith Mawlana Muhammad Zakariyya Kandhelwi again visited Darul Uloom Bury for the graduation ceremony of the very first group of students who had completed the Alim course. The final lesson of Sahih al-Bukhari was conducted by Shaykh al-Hadith Mawlana Muhammad Zakariyya Kandhelwi in the presence of thousands of people who had arrived from all corners of the UK. During this visit, Shaykh al-Hadith Mawlana Muhammad Zakariyya Kandhelwi stayed in the UK for twenty one days and visited various towns and cities across the country.

Students

Most Alims and Islamic Scholars in the UK are direct or indirect students of the Shaykh. To date, over 1000 students have studied and graduated as Alims from Darul Uloom Bury. Another 1000 female students have completed the Alimah course from Jamiatul Imam Muhammad Zakariyya, Bradford, which was also established by the Shaykh. Apart from these many more students of Sacred Knowledge have qualified as Alims from various Institutes established by the Shaykh or the students of

the Shaykh.

As the first Darul Uloom in the Western world, Darul Uloom Bury has attracted students from many foreign countries, including, Canada, France, Morocco, New Zealand, Panama, Portugal, Panama, United states of America, Reunion.

Seminaries established by the Shaykh

Along with Darul Uloom Bury the Shaykh established several institutes across the UK. The list is as follows:

- Darul Uloom al-Arabiyyah al-Islamiyyah, Bury (Boys Boarding)
- Madinatul Uloom al Islamiya, Kidderminster (Boys Boarding)
- Jamiatul Imam Muhammad Zakariya, Bradford (Girls Boarding)
- Markaz ul-Uloom, Blackburn (Boys Boarding and Girls daytime)
- Madrasa al-Imam Muhammad Zakariya, Bolton (Girls daytime)
- Imam Muhammad Zakariya School, Preston (Primary school)
- Madrasa Imam Muhammad Zakariya, Preston (Girls daytime)
- Azhar Academy, London (Girls school and daytime madrasah)
- Al Markazul Ilmi, Dewsbury, (Girls daytime)
- Mahad al-Shuhada Mosque and Madrasa, Preston (Girls daytime)
- Imam Muhammad Zakariya Masjid and Maktab, Dundee

Teaching Services

The Shaykh taught at Darul

Uloom Bury since its inception in 1973. For approximately eleven years, the Shaykh taught Sunan al-Tirmidhi, one of the most important Hadith book in the curriculum of graduating Alim course students. In 1996, after the demise of the Shaykh al-Hadith Mawlana Islamul Haq Sahib (d. 1996), the Shaykh started teaching Ṣaḥīḥ al-Bukhari and continued doing so until his demise. The Shaykh also taught many other books including, Sahih al-Muslim, Sunan ibn Majah, Mishkaat al-Masabeeh, Tajreed as-Sareeh and the translation of the Holy Qur'an.

Spiritual Gathering & Lectures

The Shaykh served as a spiritual guide for many thousands of people across the world. For many decades the Shaykh conducted a Thursday gathering where many hundreds of people would eagerly attend and benefit from his company. During the Holy Month of Ramadhan, many hundreds of people would participate in the Etikaaf (Spiritual retreat) held in the Darul Uloom Masjid. Shaykh would provide daily spiritual guidance and advice.

Ramadhan Lectures

Since 2012, during the Month of Ramadhan, for 8 years until his demise, the Shaykh would provide a daily 30 minute lecture on spirituality and self-reformation. These lectures would be broadcast on Ramadhan Radio stations in the UK. The daily listenership to these lectures would be in the thousands.

Books & Publications

The Shaykh authored approximately 27 books,

predominantly in Urdu.

This includes the famous Adwaa'ul-Bayan which is a very captivating, fresh rendition of the meanings of the Noble Qur'an into Urdu. This translation is used by many students of Sacred Knowledge across the world.

Demise

The Shaykh had travelled to Canada on Wednesday 14 August 2019 with his family to deliver some Hadith lectures and programmes. During his stay, on the morning of Sunday 25 August 2019, the Shaykh suffered a heart attack and remained in a state of coma until he passed on Sunday 8 September 2019 after Maghrib Salah at 8.20pm Canada time.

The Janazah Salah was performed on Monday 9 September 2019 at the Jame Masjid in Mississauga, Toronto, Canada. The Janazah Salah was led by his son in law Mawlana Junaid Desai Sahib and the Shaykh was thereafter laid to rest in Glenview Memorial Gardens in the Paradise Garden section.

The Shaykh left behind him, apart from the thousands of students and associates, eight children. Two of the Shaykh's sons Mawlana Muhammad and Mawlana Sulayman are graduates of Darul Uloom Bury and are currently teaching at the Institute.

We pray to Almighty that he bless the family, students and associates of the Shaykh and grant them patience and reward upon the loss.

O Almighty, do not deprive us of his reward and do not afflict us into a test after him.

IMWS & Rabetah Remembers Sunday programme

Continued from page 1

The programme commenced with recitation of the Qur'an by Qari Saeed Makda, a graduate of Darul Uloom, Bury. This was followed by an introduction to the purpose of the event by Imam of Jame Masjid, Mawlana Muhammad Mota. Mawlana Muhammad described among Hazrat's great achievements, the things which stood out most in his view, noting Hazrat's deeply visible love for Rasūlullah sallallahu alaihi wa sallam solidifying his reputation as Aashiq e Rasūl. Mawlana also expressed his admiration for the students of Hazrat, the likes of Mawlana Saleem Dhorat, Mawlana Riyadhul Haq, Mufti Abdur Rahman Mangera, and many others who continue to have such a profound influence upon Muslims in the UK. This he said, was a matter of great admiration, acknowledged by an Aalim who did not graduate from Darul Uloom Bury.

Mawlana Shokat Dadiwala, a graduate from Darul Uloom Bury, spoke of the pain on the departure of Hazrat and Qari Wasiullah Kholwadia recited some couplets in Urdu composed by Mawlana Abdul Hai Sidat (Nadir Lajpuri). Next to remember Hazrat, Iqbal Bhana OBE talked about some of Hazrat's accomplishments as a visionary, such as his support for broadcasting Azan over the receiver system, now commonplace in Muslim households across the UK. Following this, Dr Abdur Rahman Rajpura spoke in Gujarati about the close historic relations Hazrat had with the people of Batley. Among his support, Hazrat was involved in naming local community organisations like ICWA, and advised elders of the community when they were fundraising for the new Madina Masjid in Mount Pleasant. Ahmad bhai Gul OBE extended the sentiment shared by Dr Rajpura, describing Hazrat's supportive nature and

humility, making others feel they were close friends. Ahmad bhai noted Hazrat's consideration for others being exemplary, citing an incident in which he wished to accompany Hazrat on a journey, but Hazrat pointed out that it would be detrimental to Ahmad bhai's income as a driving instructor to take time of work on a Saturday. Such regard for the finer details of the lives of others is rare to see. Ahmad bhai was followed by Mawlana Dr Ebrahim Dadibhai, who lauded Hazrat's astonishing legacy of leaving behind 'factories' producing Muslim scholars, and explained how this should be a lesson for others.

Mawlana Khalil Kazi, founder of Madina Academy and a senior student, expounded upon the early experiences of Hazrat, remembering his immense courage in setting out to establish Darul Uloom in a climate of widespread scepticism. Drawing from Hazrat's successes, Mawlana Khalil emphasised the need for each of us to hold close the example of both Rasūlullah sallallahu alaihi wa sallam as well as a shaykh (spiritual mentor) or Ālim to help us navigate through life's challenges. Next, Mawlana Shoaib Patel emotionally rendered some poetry composed by Mawlana Abdul Hai Sidat (Nadir Lajpuri).

Hazrat Mawlana Abdur Rauf sahib briefly addressed the audience explaining that his time was being given to Hazrat's close student who would be able to give a much closer perspective on Hazrat.

The closing speech was



Madinatul Uloom Kidderminster

delivered by Mawlana Ismail Raja, lecturer of Sahih Al Bukhari at the girls' Madaris in Dewsbury and Bradford. Mawlana described Hazrat's deep affection for the people of Batley, and his impassioned interest in the acquisition of the new building for Al Markazul Ilmi, as well as the financial support for Jamia girls Madrassa in Bradford coming from Batley. Such was Hazrat's affection and regard for Batley's Muslim community, no doubt a

reflection of the large number of parents from Batley who sent their children to study at Darul Uloom Bury in the early years.

Concluding, Mawlana Ismail sb held back his tears to describe Hazrat's deep attachment to the sunnah as a lesson for us all.

Final words of thanks were shared by Dr Imtiyaz as Chair of IMWS.

The programme concluded with dua by Mawlana Abdur

Rauf Saheb praying for the safeguarding of the institutions established by Hazrat, and for the pouring of serenity upon his soul.

IMWS and Rabetah extend their gratitude to all guests, volunteers and attendees.

May Allah Ta'ala reward Hazrat immensely for his sacrifices on behalf of us here in Batley, and flourish the gardens of Hazrat's efforts across the globe. Aameen

Gaza feedback report on food and medical centre

Last month Indian Muslim Welfare Society working in partnership with Palestinian Welfare House (PWH) completed two projects in Gaza. The projects were aimed at helping and supporting poor and orphan families with food parcels in order to help them to face difficulties of life and to meet their basic needs.

The first project provided food parcels for 160 families which included beans, meat, oil, tea, humus, rice, sugar, salt, tahina, lima beans and other essential needs.

The second project provided medical aid for Jabalia Medical Centre which needed

medication for 400 patients of poor families, especially women and children.

Ilyas Norat, chair of IMWS Charity fund subcommittee, said "we have been working with PWH for many years and we have been privileged enough to help thousands of people with food, medical and clothing projects in Gaza ... and we pray this continues", Ilyas wanted to thank everyone that has donated towards these projects and most of all to remember them in your duas.

IMWS collects funds for Gaza throughout the year, please continue to support IMWS.



Plans to revive Dewsbury Town Centre

Kirklees Council's Cabinet has approved plans to improve shop fronts and bring vacant space back into use in Dewsbury Town Centre.

Cabinet considered and approved plans on 10 September with a view to launching the scheme in early 2020 in the Dewsbury Town Centre Conservation Area.

The scheme will follow the success of The Dewsbury Townscape Heritage Initiative (THI); a joint funded programme which commenced in 2013 between Kirklees Council and the Heritage Lottery Fund with funding of £3.7 million.

Cllr Peter McBride, Cabinet Member for Regeneration said:

"I'm really pleased that Cabinet approved revival plans for Dewsbury. We've seen huge success and changes for the better from the Dewsbury Townscape Initiative and I'm confident that we can continue this success.

The current appearance of many of the shop fronts is a result of various factors including the decline in retail activity in the town centre, a legacy of poor workmanship, display of ill-considered advertisements, lack of maintenance and some unauthorised alterations.

The combination of these factors fail to provide a good appearance for the buildings and the town centre. Given that a large part of the town centre is a conservation area then these issues become emphasised.

The grant scheme will go a long way to improving Dewsbury town centre, making it more appealing and attractive for both local residents and visitors to the area."

Areas of activity will cover all the Dewsbury Town Centre Conservation Area; with a specific focus on the core part of the town centre including Northgate, Westgate, and Corporation Street among others.

The Batley Gala

Last month Indian Muslim Welfare Society working in partnership with Palestinian Welfare House (PWH) completed two projects in Gaza. The projects were aimed at helping and supporting poor and orphan families with food parcels in order to help them to face difficulties of life and to meet their basic needs.

The first project provided food parcels for 160 families which

included beans, meat, oil, tea, humus, rice, sugar, salt, tahina, lima beans and other essential needs.

The second project provided medical aid for Jabalia Medical Centre which needed medication for 400 patients of poor families, especially women and children.

Ilyas Norat, chair of IMWS Charity fund subcommittee, said "we have been working



No Money a Reasonable Excuse for Not Paying Tax

HM REVENUE and Customs (HMRC) are not known for being lenient when it comes to taxpayers who fail to pay taxes, and mere inability to pay tax when due is only regarded as a 'reasonable excuse' (and therefore ground for avoiding penalties) when the inability is 'attributable to events outside the person's control'.

When a man with a portfolio of properties sold one, making a gain which led to a substantial tax liability, HMRC did not accept that he had a reasonable excuse for failing

to pay the tax because he did not have the money to do so. The reason why he could not pay the tax was that his bankers (who had made sizeable loans to him) insisted that he remit all the sale proceeds to them to reduce his debt and refused to release their charge on the property unless he agreed to do so.

He appealed to the Tribunal, which agreed that his inability to pay the tax was indeed out of his control: he could not complete the sale if the bank did not release its charge

and it would not release its charge unless it retained the whole of the sale proceeds. Accordingly, he had none of the profit on sale, on which the tax charge was based, to pay the tax and he had a reasonable excuse for non-payment. The penalty was quashed.

The content of this article is provided for general information only. It is not intended to be relied upon as a comprehensive statement of law or to apply in every particular and individual set of circumstances. Please take independent legal advice.

Your MP's say

"Whilst Parliament has been suspended and the outrageous shambles that is Brexit rages on, I've been using the time in my constituency to get along to as many local groups and events as possible.

Before my surgery appointments on Saturday I was pleased to join the Kashmir demonstration, to show my solidarity with the people of Kashmir and to see the event organised by Friends of Kashmir so well attended.

It is imperative that the curfew is lifted and humanitarian aid is allowed into occupied Kashmir – I'll keep calling on the Government and Foreign

Paula Sherriff MP

Secretary to do everything in their power to de-escalate this situation, and help bring an end to the cycle of violence and fear.

Other recent events have included my first Older People's Fair, showcasing the groups and organisations we have in our area for older people, and I'm proud it was a great success. It is great that locally we have so many groups, often volunteer led, providing support and valuable social networks to older people.

Amongst the issues being raised with me, I am deeply concerned that the same think tank that came up with Universal Credit is now laying

the groundwork to increase the retirement age to 75 by 2035. Just nine years from now, the retirement age would go up to 70 as the change is phased in.

Alongside this, the removal of the free TV licence scheme for many over 75s, the unfair acceleration of the women's state pension age and the widely reported crisis in adult social care - there's a lot to contend with for older generations.

When Parliament returns, I'll continue to press for measures that ensure dignity and security in retirement.

We're back!

Do you want to make a difference? The IMWS Women's Committee are re-launching and recruiting new members with fresh ideas. In the past the Women's Committee have done an array of activities including the ever popular salah and fiqh workshops, developed structured activities for young girls to get involved in including Brownies and Guides, army challenge days, and activities to promote better health and wellbeing such as fit and fun days, indoor cycling and yoga.

We are looking for more women from all walks of life, to join in. We meet every 6 weeks to discuss current needs and opportunities that can

be utilised and plan activities and workshops. If you have any innovative ideas get in touch and let us know how we can serve the women in our community better. <https://www.surveymonkey.com/s/T9LMB5Q>

In return we can offer networking opportunities, a chance to give back to your community, improve things, get your voice heard and make a difference!

Interested? Our next meeting is on Tuesday 5th November, Al Hikmah Centre at 5.30pm. Hope to see you there.

Follow us on Twitter @imws_women, Instagram @imwscommitteewomens or send us an email sisters@imws.org.uk

Burial contact numbers

EBRAHIMBHAI CHOPDAT

07980 381197

GULAMBHAI MANIYAR

07801 825691

ISMALBHAI E.DAJI

07779 227947

MOHAMMED PANDOR

07960066973

Kirklees Council Burial Fess

for 2019 – 2020

(as of 1st April 2019)

Adult Timber Grave **£2164**

Child Timber Grave

Under 18yrs

£70

Give your business the boost it deserves

Paigaam

With over 25 years in publication.
Distributed through 15 local masjids after Jumma Salaah.
Online, email and posted out to subscribers.
Paigaam is the most popular and established community publication in the region.

Why not give your business exposure to a wide and longstanding readership.

For more information contact paigaam@imws.org.uk
or call us on: **01924 500 555**

EST. 1993
FREE Tri-lingual Monthly Community Magazine





Batley Ninjas is a local women's Rounders team, which was established by Rashida Salloo of Ready Steady Active (RSA), in 2013. The group had very humble beginnings, with only 9 players. The story it has to tell today though, is nothing short of remarkable and testament to how wonderful things can happen when our womenfolk work together, united towards a common goal.

Let's go back to the beginning shall we?

Rashida Salloo started women-only Rounders sessions, as a way of providing women in the local community with access to sports, healthier lifestyles as well as a social support network; something that really wasn't available at all up to this point in a women only sports arena. Once teams were established, the very first RSA league took place in 2013. From this initiative would tentatively emerge the fledgling Batley Ninjas team, under the Captainship of Sofiya Makda, very new to the scene and a little unsure of exactly how things would pan out.

Today, Batley Ninjas really has grown into its own and proudly stands 28 members strong. Their members come

from all walks of life, from housewives, to professional career go-getters, to business entrepreneurs, to young teenagers. There are absolutely no barriers to who can join - it is quite simply, when everything else is stripped away, a safe place where women can enjoy playing sport, getting active, making friends and having fun.

The Batley Ninjas are very much a family orientated, child friendly team. Training for younger members (Ninjettes) has recently been introduced. And it is very unlikely that you will come across the older Ninjas training, without an entourage of mini Ninjettes in tow. It is what makes them inclusive in the truest sense of the word.

Not only do Batley Ninjas continue to participate in both the Summer and Winter RSA leagues, this year they dared to venture out further and join the Rounders in Leeds League. It was an amazing experience



Batley Ninjas

and really showcased how Rounders can unify people from such diverse backgrounds under a common umbrella. Batley Ninjas had a wonderful season and placed 3rd in the League table.

Some members of the Batley Ninjas team also participated in a one day tournament in Burnley, alongside players from other teams. They came away winning the Plate Finals, another fantastic achievement.

As a result, the team have been 'noticed' by media outlets such as Look North and BBC Sport, who both ran features on them, and more recently an article is in the pipeline for the 'Sport & Physical Activity Magazine'.

When all is said and done though, all the Batley Ninjas really want, is to be able to play the sport they love and are passionate about, without barriers and prejudice. They train every Sunday, between 12 and 2pm, at Hyrstlands Park, and will happily welcome any newcomers to training. Follow them on Facebook, Instagram and Twitter for live updates on training and league matches. Batley Ninjas are currently on the lookout for sponsors to fund their club once the new season begins in Winter. If you are interested in collaborating with the Batley Ninjas on their ventures, please get in touch with the team Captain, Sofiya Makda, on 07514 372582.

Mount Cricket Club Successfully Delivers 'Healthy Holidays Summer Camp' In Partnership With Kirklees Youth Alliance

The summer school holidays are over, yet at the start many parents face the dilemma of how to fill all that time. What seems like endless weeks stretch out in front, the challenge was how to keep children affordably occupied and maybe throw in a bit of education, lots of fun & laughter and at the same time learn about the benefits of healthy eating.

Mount Cricket Club is proud to have delivered its first 'Healthy Holidays Summer Camp' in partnership with Kirklees Youth Alliance (KYA) and supported by Kirklees Council. This was another first in the Club's history of delivering a comprehensive Summer Camp Package for over 4 hours a day, 4 days a week for 4 continuous weeks focussing on educational, social as well as physical sporting activities and of course involving cricket! Each session was topped off with deliciously healthy and freshly prepared hot meals sourced from Sugar 'n' Spice a local community based catering business, who rustled up in excess of 450 meals.

The 'Field of Dreams' was open to children aged between 5 - 13 from Batley, Dewsbury, Heckmondwike, Liversedge and surrounding areas and proved so popular that on average 28 plus youngsters attended each session, against a set target of 25. Each week, new registrations were received, right up until the last day – when 4 children were added. On the days when the great British weather

was not kind the Club ensured the children did not miss out on the fun and activities. Necessary arrangements were made with the Al-Hikmah Centre and sessions delivered in the sports hall with the additional cost being absorbed by KYA. The Club expresses its sincere thanks to the Indian Muslim Welfare Society (IMWS) for their co-operation and KYA for meeting the extra cost.

To fully assess the impact of the Healthy Holidays Programme, all parents were given a feedback form. The overwhelming satisfaction was truly humbling from the testimonials from parents and carers.

Tracy Brabin, Batley & Spen MP & Shadow Minister for Early Years, expressed the following comment:

"It has been an incredible summer for Cricket and Mount Cricket Club who are an incredible organisation. They continually show exactly what a sports club should be, embedded in and supportive of its community. The Healthy Holiday Summer Camp is pioneering and something I would like to see expanded and as many local children as possible should be spending their holidays learning and growing in a safe and healthy environment".

Mark Arthur, Chief Executive of Yorkshire Cricket Club commented as follows:

"Mount Cricket Club serves its community with great distinction and has significantly contributed to community cricket in Batley for

more than 40 years. It continues to offer opportunities to boys and girls of all ages, on this occasion 450 of them receiving quality coaching and an all-encompassing summer programme, including physical activity, well-being and most importantly helping youngsters develop key life skills. I've had the pleasure of attending a number of the Club's programmes, matches and initiatives and the work they do always seems to get children playing the sport, in a fun environment, whilst promoting self-confidence and friendship at every opportunity – what wonderful values".

Abdul A Ravat, Mount's Development Officer reflected on the initiative and had the final comment:

"On behalf of the Chair Hanif Mayet and everyone at the Family Club, this is another great example of how a cricket club can truly serve its community. Thank you to all the parents for trusting your children in our care, something we never take for granted. Thank you also for KYA and Kirklees Council for providing the opportunity to demonstrate our approach, capability and deliver some amazing outcomes. There is so much untapped talent and potential at the Club and with better facilities and resources we have the capability to expand to provide a huge range of services and opportunities for young people with the expertise we already have. If we did have better facilities then we would not need to shift the children elsewhere when it's raining outside and we can deliver programmes throughout the year for the betterment of our community".



Common Cold

What is a cold and what causes it?

A cold is an infection of the nose, throat and upper chest caused by a virus. Many different viruses can cause a cold. This is why colds recur, and immunisation against colds is not possible. Children tend to have more colds than adults as adults have built up immunity to many viruses. Adults have an average of 2-4 colds a year. Young children have an average of 3-8 colds a year.

What are the symptoms of a cold?

- The common symptoms are a blocked nose, a runny nose, and sneezing. At first there is a clear discharge (mucus) from the nose. This often becomes thick and yellow/green after 2-3 days.
- You may feel generally unwell and tired, and you may develop a mild fever.
- Sometimes there is a mild sore throat, hoarseness and a cough.
- A build up of mucus behind the eardrums may cause dulled hearing or mild earache.

Symptoms typically peak after 2-3 days and then gradually ease off. Symptoms have usually gone within a week. However a cough may linger for up to three weeks, often when other symptoms have gone.

What are the treatments for a cold?

There is no magic cure for the common cold! There is no treatment that will shorten the length of the infection. Treatment aims to ease symptoms whilst your immune system clears the virus.

Note: antibiotics do not kill viruses, so are of no use for colds.

The most useful treatments are:

- Paracetamol or ibuprofen which will ease fever, sore throats, aches and pains.
- Make sure you drink enough or give your child plenty to drink. Drink plenty to prevent dehydration which can make you feel more tired, and may cause a headache. Hot drinks are often soothing too.



- A steam inhalation may help to 'clear the nose'. A hot steamy shower is perhaps a safer option.
- A menthol sweet may also clear a bunged up nose for a while.
- Saline drops is a popular treatment for a bunged-up nose in a baby. Consider putting a few drops of saline (salt water) into the nose just before feeds. You can buy saline drops from pharmacies.
- Some preparations based on the herb of Echinacea purpurea (a herbal remedy) might decrease the severity of cold symptoms in adults.

Healthcare professionals no longer advise using over-the-counter cough and cold medicines for children under 6 years of age. There is no evidence that they work and they could cause side-effects, such as allergies, drowsiness or hallucinations.

Note: paracetamol and ibuprofen are not classed as cough and cold medicines and can still be given to children.

Are there any possible complications from a cold?

Most colds do not cause complications. Sometimes the infection travels to the chest, sinuses, or ears and cause a bacteria infection. Therefore, consult a doctor if you develop any of these symptoms:

- Fever, wheezing or headaches that become worse or severe.
- Fast breathing, shortness of breath, chest pains, or if you cough up blood.
- Noisy breathing or difficulty breathing - especially in a child.
- Unusual irritability or persistent crying in a baby.
- Persistent earache.
- Drowsiness or confusion.
- A cough that persists longer than 3-4 weeks.

Can colds be prevented?

- People with colds should not get too close to others. For example, kissing, hugging, etc.
- If you have a cold, wash your hands often with soap and water as viruses are passed on by touch.
- Avoid sharing towels, flannels, etc if you or someone else has a cold,
- For children, discourage the sharing of toys belonging to a child with a cold. If your child has a cold, consider washing toys with soapy water after use.

Exercise may help too

An interesting research study conducted by Dr Nieman and his team in 2010, at The Human Performance Laboratory at Appalachian State University in North Carolina, concluded that people who exercise regularly (exercised on five or more days a week eg 30 minute brisk walk) are less likely to get respiratory infections such as a cold. And, if someone who exercised regularly developed a cold, there was a good chance that symptoms would be less severe than someone with a cold who did little exercise.



If you or anyone living with you are or benefits

RJ FREE ECO GRANTS

FOR

- BOILER
- FULL CENTRAL HEATING
- UNDER FLOOR INSULATION
- ROOM IN ROOF INSULATION
- WALL INSULATION

For a free assessment call your space adviser on **07789 315 543** today!

 Free Boiler under the ECO scheme

NHS eyecare

free 2nd pair for kids

Student Offers
50%
OFF DESIGNER FRAMES**

Bring your NHS vouchers to us

ADAMS OPTICIANS

41 SOUTH ST, SAVILE TOWN, WF12 9NB
01924 506466 / 07967 835886

LIVING SPACE
ARCHITECTURE

SPECIALISING IN
**HOME EXTENSIONS
LOFT CONVERSIONS
OUTBUILDINGS
REMODELLING**

OVER 17 YEARS OF EXPERIENCE
PROFESSIONAL & FRIENDLY
EXPERT INDEPENDANT ADVICE

**ARCHITECTURAL & INTERIOR DESIGN
PLANNING & BUILDING REGS PROJECT MANAGEMENT**

Units 21, The Collette, 42 Wakefield Road, Dewsbury WF12 9NF

GIVE US A CALL TODAY 01924 692090



J.B. JOINERY FREE Quotes

All Aspects of Joinery Work Undertaken

- > Roofs > Loft Conversions
- > Kitchens > Laminating
- > Doors > UPVC
- > Decking & Fencing
- > All Aspects of Plastering Work Undertaken

For a friendly & professional service
Call James: 07747 440 778 or 01924 465928



DK ARCHITECTS 25 YEARS

Hamid Dhorat RIBA, ARS, MCIOB
BA(Hons) MArch Architecture
RIBA Chartered Architect

Architecture • Design • Planning Permission
Building Regulation • Structural Engineering
Extensions • Conversions • New Build • Residential
Commercial • Industrial • Full Architectural Services

www.dkarchitects.net
01924 477212
07718 990668
info@dkarchitects.net

Local Offices at Batley Business
Park Suite 4 Technology Drive
Batley WF17 6GR

Royal Institute of British Architects





**NOT HAVING YOUR FIRE/BOILER SERVICED CAN BE FATAL
WHEN WAS THE LAST TIME YOU HAD YOURS CHECKED?**

BE SAFE WITH

IB GAS SERVICES

- FIRES • BOILERS • WATER HEATERS , ETC
- LANDLORD CERTIFICATES AND CONTRACT WORK NEGOTIABLE • GAS SAFETY CHECKS
- INSTALLATIONS AND PLUMBING WORK UNDERTAKEN

Contact ISHAQ on:
07890403647 or 01924 509781



Do you or someone you know require Day Care?

Milen Care

Al-Hikmah Centre
28 Track Road
Batley
WF17 7AA

Milen Care provides quality day care services for Asian elders.

We provide:

- Freshly cooked Halal meals
- Pick up service
- Regular outings
- Opportunity to meet old and new friends
- Health and Exercise sessions / talks
- Activities of interest
- Flexible care package available

We welcome individual budget holders & accept direct payments

For further information and informal chat contact Shahed Mayet on

01924 470774

or visit our website at www.milen.org.uk

Milen Care is a Registered Charity No 1129282
Funded by Millen Council

Mother Hubbards™

Famous Fish & Chips

Since 1972

She's Here!!

So close you can almost taste it....



604 BRADFORD ROAD,
BATLEY, WF17 8HA T:01924 471555
BRADFORD | LEEDS | BATLEY | HALIFAX | WAKEFIELD



A1
CATERING

Disposable
Products

"Packaging for food"

GLASSES NOW IN STOCK

Tel: 01924 456 786. Email: sales@a1cdp.com Web: www.a1cdp.com

Providence Works, Henry Street, Batley
West Yorkshire WF17 6JJ



NADAT SOLICITORS

Telephone: 01924 505 071

4 Bond Street, Dewsbury, West Yorkshire WF13 1AG

Family Law

Divorce - Separation - Financial Settlements
Children Law Matters - Domestic Violence
Cohabitation - Pre-Nuptial Agreements
& General Family Law Matters

Legal Aid may be available (subject to eligibility)

Please contact us for assistance with Powers of Attorneys, Wills, Change of Name Deeds, Commissioner for Oaths and Immigration matters (spouse visa / sponsorship / leave to remain and citizenship applications)

We may also be able to provide assistance with other legal problems

Inayat Nadat our Principal Solicitor is a Resolution Accredited Specialist in areas of Children (Private Law) / Domestic Violence




resolution
first for family law

ONLY
Home & Dads



the accredited family law specialist



LOONAT Catering Services

- | Foods
- | Waiters
- | Kitchen Staff
- | Cutlery & Crockery
- | Buffets Venue



FREE PHONE
0800 505 3229

www.loonates.co.uk

Unit B&C | Savile Street | Batley | WF17 6JS

info@loonates.co.uk



Plumbing and Heating **ALL WORK GUARANTEED**

GasSafe Registered 220345



No Call-Out Charge!
Competitive Prices!

- All types of plumbing work
- Radiators Replace/Repair
- Boiler Install/Repair/Service
- Power Flush
- Landlords Gas Certificate
- Outside and Inside Drainage
- Unblocking
- Gas Fire/Cooker Install/Service/Repair
- Shower Install/Repair

Please Contact Adam Fulat on
07939 059938

A & I BLINDS DIRECT

A & I SOFT FURNISHING

Quality Blinds at Low Prices

Specialist in Conservatory & Perfect Fit Brands

- * Verticals
- * Venetians
- * Pleated
- * Rollers
- * Wood Slat
- * Romans



Made to measure

For A Free Quote Call

07812 606299 or 01924 460852

Conference Facilities at the Al-Hikmah Centre



Training Seminars

Conference Halls

Meeting Rooms

Workshops

Functions

Events

for more information call:

01924 500 555

or email info@imws.org.uk

IMWS

Al-Hikmah Centre, 28 Track Road, Batley. WF17 7AA

Eight practical tips for healthy eating

The key to healthy diet is to eat the right amount of calories for how active you are and to eat a wide range of food for a balanced diet.

The recommendation for men is to have around 2,500 calories (10,500 kilojoules) whilst women should have around 2,000 calories (8,400 kilojoules).

Base your meals on starchy carbohydrates

Starchy carbohydrates should make up just over one third of the food you eat.

These include potatoes, bread, rice, pasta and cereals.

Choose wholegrain varieties or eat potatoes with their skins on, they contain

more fibre, and can help you feel full for longer. Try to include at least one starchy food with each main meal.

Eat lots of fruit and veg

It's recommended to eat at least five portions of a variety of fruit and veg every day.

Unsweetened 100% fruit juice, vegetable juice and smoothies can only ever count as a maximum of one portion of your 5 A DAY. For example, if you have two glasses of fruit juice and a smoothie in one day, that still only counts as one portion.

Eat more fish

Fish is a good source of protein and contains many vitamins and minerals. Aim to eat at least two portions of fish a week, including at least one portion of oily fish. Oily fish contains omega-3 fats, which may help to prevent heart disease.

Oily fish include: salmon, mackerel, trout, herring, fresh tuna, sardines, pilchards.

Non-oily fish include: haddock, plaice, coley, cod, canned tuna, skate, hake.

Cut down on saturated fat and sugar

We all need some fat in our diet, but it's important to pay attention to the amount and type of fat we're eating. There are two main types of fat: saturated and unsaturated.

The average man should have no more than 30g saturated fat a day. The average woman should have no more than 20g saturated fat a day, and children should have less than adults.

Saturated fat is found: hard cheese, cakes, biscuits, cream, butter, pies.

For a healthier choice, use just a small amount of vegetable oil or reduced-fat spread instead of butter, lard or ghee.

Sugar in our diet

Sugary foods and drinks are often high in energy and if eaten too often can contribute to weight gain.

Many packaged foods and drinks contain high amounts of free sugars. Free sugars are any sugars added to foods or drinks, or found naturally in honey, syrups and unsweetened fruit juices.

Use food labels to check how much sugar foods contain. More than 22.5g of total sugars per 100g means that the food is high in sugar, while 5g of total sugars or less per 100g means that the food is low in sugar.

Eat less salt – no more than 6g a day for adults

Eating too much salt can raise your blood pressure.

Even if you don't add salt to your food, you may still be eating too much. About three-quarters of the salt we eat is already in the food we buy, such as breakfast cereals, soups, breads and sauces.

Use food labels to help you cut down.

More than 1.5g of salt per 100g means the food is high in salt. Adults and children over 11 should eat no more than 6g of salt (about a teaspoonful) a day. Younger children should have even less.

Get active and be a healthy weight

If you're trying to lose weight, aim to eat less and be more active.

Physical activity can help you to maintain weight loss or be a healthy weight. Being active doesn't have to mean hours at the gym, you can find ways to fit more activity into your daily life. For example, try getting off the bus one stop early on the way home from work, and walking.

Don't get thirsty

We need to drink plenty of fluids to stop us getting dehydrated – 6-8 glasses every day is recommended. This is in addition to the fluid we get from the food we eat.

Try to avoid sugary soft and fizzy drinks that are high in added sugars and calories.

Even unsweetened fruit juice and smoothies are high in free sugar. Your combined total of drinks from fruit juice, vegetable juice and smoothies should not be more than 150ml a day – which is a small glass.

Don't skip breakfast


Some people skip breakfast because they think it will help them lose weight. In fact, research shows that people who regularly eat breakfast are less likely to be overweight.

Breakfast has also been shown to have positive effects on children's mental performance and increase their concentration throughout the morning.

A wholegrain, lower-sugar cereal with fruit sliced over the top is a tasty and nutritious breakfast.

Check whether you're a healthy weight by using the Healthy weight calculator.

www.nhs.uk/Tools/Pages/Healthyweightcalculator.aspx



Kids Corner

Morals

C	G	B	S	Y	M	P	A	T	H	Y	T	X	F	J
Y	E	O	U	V	C	T	H	F	I	N	B	P	A	C
L	N	D	X	P	O	U	T	C	A	Z	Q	C	O	U
D	T	G	O	B	J	N	P	S	B	E	P	N	M	D
N	L	E	I	O	L	D	A	Y	V	D	S	P	S	D
E	E	W	L	E	G	E	L	E	T	I	L	O	P	N
I	Q	C	X	U	L	R	I	F	D	F	H	E	B	I
R	S	A	Q	P	F	S	V	E	W	E	I	L	I	K
F	C	E	N	Y	H	T	R	O	W	T	S	U	R	T
C	O	G	J	B	H	A	C	W	V	H	K	N	D	E
X	A	L	C	O	T	N	L	E	A	D	E	E	C	I
C	D	R	N	E	C	D	F	P	P	L	B	I	D	U
X	O	E	I	E	F	I	J	E	Q	S	N	J	Q	N
F	S	S	O	N	F	N	T	R	U	E	E	F	X	L
T	H	C	H	R	G	G	P	C	M	S	B	R	M	K


- | | | |
|-------------|----------|---------------|
| Caring | Honest | Respectful |
| Considerate | Kind | Sympathy |
| Friendly | Nice | True |
| Gentle | Pleasant | Trustworthy |
| Good | Polite | Understanding |



1st Prize sponsored by Pizza GOGO
Pick up ONLY



1st Prize:
1 large family size pizza.
+ Trophy
2nd Prize: Trophy
3rd Prize: Trophy
Trophies sponsored by IMWS



Solve any puzzle and send it in to WIN a PRIZE!!!

Decode the sentence!
Crack the code to reveal a message

A	B	C	D	E	F	G	H	I	J	K	L	M	N	O	P	Q	R	S	T	U	V	W	X	Y	Z	
			7					13						22			17									

I E O E I O E R
13 7 21 23 22 10 1 7 16 14 13 21 25 22 8 1 7 17 26

A	B	C	D	E	F	G	H	I	J	K	L	M	N	O	P	Q	R	S	T	U	V	W	X	Y	Z	
			16					14						12		5										

R E E I O E R O E R
19 26 5 16 24 15 16 17 13 14 1 10 12 13 2 16 5 24 12 13 2 16 5 24
I R E E
25 14 21 21 5 16 24 15 16 17 13 23 16

Winner!

1st	Asma Sabbir Mamaniat
	Batley
2nd	Zahra Bahadur
	Batley
3rd	Ammarah Basar
	Batley

Please collect your prizes from the Al-Hikmah Centre.

Terms and conditions apply

Name and address of winning entries will be published. Age limit 13.

Please send this page with your

name, address, postcode, age and telephone number before 20th October 2019 to:

Kiddies Competition, Al-Hikmah Centre,
28 Track Road, Batley, West Yorkshire, WF17 7AA

Full Name: _____

Address: _____

Postcode: _____ Date: _____


Age: _____ Tel. No.: _____

Adult's Puzzles

L E N C T D T G D I O D W D C
 B O A G A L N N N S M D V B W
 E L N Q M I I E H O K G K L P
 V N F E P K I H S L F F D Y N
 I R O L L G E U G A E L L O C
 S Q E H H I X P V T J N G N B
 I H O B P D N D A I T V K H E
 T Y O F T E L E F O T I M E S
 S U Y C R Y L K S N V C W C T
 R Q L F O I B E H S C W F D A
 S C I T F I E M T A L K I N G
 E E M J M X J N R Y L E N O L
 Q A A J O J Y I D M B Y G O Y
 I M F T C Z N T V S H W F G U
 K X T A R G N W A W Q R A O N

Best	Helping	Seat
Caring	Isolation	Talking
Colleague	Kind	Telephone
Comfort	Loneliness	Time
Family	Lonely	Visits
Friends	Neighbour	

Fill the blanks to find a message



A L Q
 B O W H N D U H N O F
 H Y T E D V R N N E I T E Y
 T A E E H E A E N G S S I O D
 H H P T S T A K I S U S H T F

EIVATC

6 17 18 7

SACHIPLY

14 19 11 22 9 13 5

PYLIANG

16 15 20 3

NMOETYJNE

8 12 21 2 23

NUNRIGN

1 4 10

1 2 3 4 5 6 1

X
7 8 1 9 10 11 8

F
12 1 13

14 7 15 16 17 14 18 8 1

B
12 19

D
6 20

D
21 22 23

Did You Know?

The Olympic flag's colours are always red, black, blue, green, and yellow rings on a field of white. This is because at least one of those colours appears on the flag of every nation on the planet.

Chewing gum while you cut an onion will help keep you from crying.

A hardboiled egg will spin, but a soft-boiled egg will not.

Human thigh bones are stronger than concrete

The word "queue" is the only word in the English language that is still pronounced the same way when the last four letters are removed

A man named Charles Osborne had the hiccups for 69 years!

	+		+		-		25
-		/		+		+	
	+		X		-		8
+		+		+		-	
	+		X		+		84
-		+		-		+	
	+		+		+		49
11		20		-3		4	

Try to fill in the missing numbers.

Use the numbers 1 through 16 to complete the equations.

Each number is only used once.

Each row is a math equation. Each column is a maths equation.

Remember that multiplication and division are performed before addition and subtraction.

unravel the letters to form a word, discover the code and uncode the sentence

બ્રિટનના એક મહાન આલિમેદીનની આ ફાની જગતથી વિદાય

-મહંમદ યુસુફ સુફી લાજપુરી, બાટલી.

વફાત અને દફન

વલીએ કામિલ હજરત મોલાના મહંમદ તલહા સાહબ રહ.ના વસમી વિદાયના સમાચારના લખાણની સિયાહી હજુ સુકાય પણ ન હતી અને હજરત રહ.ના વફાતનો સદમો હજુ ઉમ્મતના દિલોમાંથી ભૂલાયો પણ ન હતો કે, બ્રિટનના એક મહાન આલિમેદીન દારૂલઉલૂમ, બરીના સ્થાપક કુત્બુલ અકતાબ હજરત મોલાના શયખ મહંમદ ઝકરીયા રહ.ના માનનીય અને મહબુબ ખલીફા હજરત મોલાના યુસુફ મોતાલા સાહબ રહ.ના ઈન્તેકાલની ખબર કેનેડાથી તારીખ ૯ સપ્ટેમ્બર ૨૦૧૯ સોમવારે આવી. ઈલીવએરા.

જાનકી ખુશ્બુસે મોઅત્તર થા ચમન
હા! વહી બહારે રૂખ્સત હો ગઈ

હજરત રહ. ઓગષ્ટના છેલ્લા અઠવાડિયામાં બુખારી શરીફના ઈફતેતાહી જલ્લામાં ટોરન્ટો, કેનેડા તશરીફ લઈ ગયા હતા. તારીખ ૨૪ ઓગષ્ટ શનિવારે મદ્રેસામાં બુખારી શરીફ શૂરૂ કરાવી એક નૂરાની મજલીસ થઈ હતી. હજરતનું આ અંતિમ બયાન હતું. ત્યારપછી બીજા જ દિવસે રવિવારે હજરત રહ.ને હાર્ટ એટેક થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ ૧૫દિવસ હોસ્પિટલમાં રહી સારવાર મેળવી રહ્યા હતા. રવિવાર રાત્રે એટલે કે ઈસ્લામિક રીતે સોમવાર મગરીબની નમાઝ પછી આ ફાની જગતથી તેમણે વિદાય લીધી હતી. બીજા દિવસે ઝોહરની નમાઝ પછી ટોરન્ટોમાંજ તેમની દફનવિધિ થઈ હતી.

બેતાબ આંખે ઢૂંઢતી ફીરતી હય દારૂલ ઉલૂમમેં,
સબા તુને કહાં લે જા કર ખાકે આશીયાં રખદી

પેદાઈશ અને તાલિમ

આપનો જન્મ ૧૯૪૬માં ગુજરાતના નાની નરોલી ખાતે થયો હતો. પ્રાથમિક તાલિમ ગામનાજ મદ્રેસા તર્ગીબુલ કુરઆનમાં હાંસિલ કરી વધુ તાલિમ અર્થે ૧૯૬૧માં મદ્રેસા જામીયાહ હુસેનીયાહ રાંદેર તશરીફ લઈ ગયા. અહીં હિદાયા અવ્વલેન સુધી તાલિમ હાંસિલ કરી. ત્યાંથી સહરાનપુર મદ્રેસા મઝાહીરૂલ ઉલૂમમાં દાખલો લીધો. મિશકાત શરીફ હજરત મવ. યુનુસ સાહબ રહ.થી પઢી. જલાલેન શરીફ હજરત મોલાના આકીલ સાહેબ રહ. થી, હિદાયા આખિરેન હજરત મોલાના યાહ્યા સાહબ રહ. અને અબુ દાવુદ શરીફ શેખુલ હદીસ હજરત મોલાના મહંમદ યુનુસ જોનપુરી રહ.થી. મુસ્લિમ શરીફ મોલાના મુફતી મુઝકફર હુસેન રહ.થી તહાવિ શરીફ મોલાના અસદુલ્લાહ સાહબ રહ.થી અને બુખારી શરીફ પુરી શેખુલ હદીસ હજરત મોલાના મહંમદ ઝકરીયા સાહબ મુહાજિરે મદની રહ.થી પઢવાનો શર્ક હાંસિલ થયો.

યે રૂત્બા બુલંદ મીલા જિસકો મીલ ગયા
હર શખ્સ કે વાસ્તે યે મકામ કહાં!

બયત અને ખિલાફત

બયતનો સિલસિલો પત્રના જરીયે કુત્બુલ અકતાબ શેખુલ હદીસ હજરત મોલાના મહંમદ ઝકરીયાહ રહ.થી કાયમ કર્યો. ત્યારપછી શેખુલ હદીસ રહ. થી મુલાકાત તે સમયે થઈ જ્યારે હજરત શેખ રહ. અને તબ્લીગી જમાઅતના અમીર હજરતજી મોલાના યુસુફ સાહબ રહ. સફરે હજમાં જઈ રહ્યા હતા અને દિલ્હીથી મુંબઈ આવી રહ્યા હતા. સુરત રેલ્વે સ્ટેશન પર ટ્રેનના થોભવાનો સમય ફક્ત ૩ મિનિટ હતો, પરંતુ ટ્રેન ૧૫ મિનિટ થોભી રહી. તે સમયે મદ્રેસા જામીયાહ ડાભેલ અને મદ્રેસા અશરફીયા, મદ્રેસા જામીઆ હુસેનીયાહ રાંદેરના તલહા અને ઉસ્તાદો અને હજરતના યાહકોની વિશાળ મેદની સુરત ટ્રેન સ્ટેશન ઉપર હજરતની જિયારત માટે ઊભી હતી. હજરત મોલાના યુસુફ સા. રહ. એ ટ્રેનના દરવાજા પર ઊભી રહી ૧૫ મિનિટ બયાન ફરમાવ્યું હતું.

હજરત શેખુલ હદીસ રહ. રમઝાનુલ મુબારકમાં હરમેન શરીફેન તશરીફ લઈ ગયા. ૧૫ દિવસ મક્કાહ મુકર્રમામાં કયામ ફરમાવ્યો અને છેલ્લા ૧૦ દિવસ મદીના મુન્નવરાહમાં એતેકાફ ફરમાવ્યો. હજરત મોલાના યુસુફ મોતાલા સાહેબ રહ. પણ આ મુબારક સફરમાં સાથે જ હતા. એક રાત્રે તરાવીહ પછી હજરત રહ. ને યાદ ફરમાવી બોલાવીને એક મુબારક જગ્યાએ મુબારક સમયમાં ખિલાફતથી નવાઝી ભવિષ્ય માટે કામચાબીની દુઆ આપી હતી. મોલાના યુસુફ મોતાલા રહ.નું બ્રિટનમાં આગમન તેમની યુવાનીમાં થયું હતું. તે વખત બ્રિટનમાં લોકો ફક્ત પૈસા કમાવા માટે આવ્યા હતા. જ્યારે એજ સમયે હજરત રહ.એ દીનની ફિકર કરી અને પછી તેમના શયખના મશ્વેરાથી બરી ખાતે દારૂલ ઉલૂમની સ્થાપના કરી. પ્રથમ આ કામ માટે તેમણે ઘણીજ જદોજહદ કરવી પડી પરંતુ તેમણે હિંમત હારી નહીં. તેમના આ નેક કામમાં હર તરફથી મદદ મળતી રહી. આજે તેમનાજ અઘાગ પ્રયત્નોથી બ્રિટનના અનેક શહેરોમાં મદ્રેસાઓ અને દારૂલ ઉલૂમો જોવા મળે છે. દારૂલ ઉલૂમ બરીમાંથી ફારેગ થયેલ સેંકડો આલિમો આજે વિશ્વના ખૂણે ખૂણે ઈસ્લામનો પરચમ લહેરાવી રહ્યા છે.

બાટલીની અંતિમ મુલાકાત

તારીખ ૫ એપ્રિલ જુમ્માના મુબારક દિવસે હજરત રહ. જામે મસ્જિદ હેનરી સ્ટ્રીટની ખાસ દાવત પર તશરીફ લાવ્યા હતા. મગરિબની નમાઝ પછી બયાન ફરમાવ્યું હતું. ત્યારપછી મસ્જિદે તલહા જ્યાં નવી મસ્જિદનું બાંધકામ શરૂ થવાનું હતું ત્યાં દુઆ ફરમાવી હતી. ત્યાંથી પાર્ક રોડ પર આવેલી નવી મસ્જિદે તકવા જઈ દુઆ ફરમાવી હતી. તારીખ ૨૭ એપ્રિલ શનિવારે મસ્જિદે મહમુદીયા ટેલર સ્ટ્રીટની ખાસ દાવત પર મદ્રેસા જાનતુલ ઈસ્લામના બાળકોના ખત્તે કુરઆન મજીદના મોકા પર તશરીફ લાવ્યા હતા. અહીંયાથી હીલી લેન પર નવી મસ્જિદ માટે ખાસ દુઆઓ ફરમાવી હતી અને સાથે આ મસ્જિદ મદ્રેસાના નવા તામિરીકામનું નિરિક્ષણ પણ કર્યું હતું. અહીં ખાસ વાત યાદ રાખવી જરૂરી છે કે, એ સિવાય પણ બાટલી સાથે હજરતનો ગાઢ સંબંધ, પ્રેમ હર હંમેશ જોડાયેલ હતો. તેમની અહીંની મુલાકાતના લેખો પયગામના અંકોમાં પ્રસિધ્ધ થતા રહ્યા છે.

આતી રહેગી તુમ્હારે અનફાસકી ખુશ્બુ
તુમ્હારી યાદોકા ચમન મહકતાહી રહેગા.

**હઝરત મૌલાના યુસુફ મોતાલા સાહેબની
વસમી વિદાય -અબમદ ગુલ**

ઈન્દિયાનો એજ સભ્યે સાચ પડ્યો છે બની

હોયના વ્યક્તિને એનું નામ બોલાયા કરે,

તારીખ ૯મી સપ્ટેમ્બર ૨૦૧૯ના એક એવી આંવી આવી જે જન્મની આત્મની જેમ વાસુદેવે પૂરા ક્રિટનમાં બધે વિશ્વભરમાં ફેલાઈ ગઈ અને મુસ્લિમ સમાજને સદમાની અર્તામાં ડૂબાડી દીધો. કોઈને પણ માનવામાં પણ ન આવે એવા સમાચાર. પણ વસ્તુવિક્રમ અને સત્ય તો એજ રહ્યું કે, હઝરત મૌલાના સાહેબ આ ફાની દુનિયા તજીને અલ્લા ગયા. ઈલીવએરા.

મૌલાના ઓમરના છેલ્લા અઠવાડિયામાં સુખારી શરીફના ઈફ્ટેતાહી જાલામાં શરીફ બવા ટોરન્ટો, કેનેડા ગયા હતા. તેજ કેનેડાની મિહીમાં હજારો લોકોની અજુબારા વ્હાવતી હાજરીમાં એને સુપુર્ટ ખાક કરી દેવામાં આવ્યા હતા.

હઝરતના બાટલી સાહેબા સંબંધો

બાટલી સાહે સંબંધોના પૂરાવા તો અગમિત છે. પણ અહીં થોડાક મંત્રણોની રજૂઆત કરું છું.

મૌલાનાનો બાટલી સાહેનો નહોતો અભૂતપૂર્વ હતો. જ્યારે પણ કોઈ અહમ કાર્ય હોય અથવા કોઈ મહાન વિઝ્યુઝિલું આવજન થયું હોય ત્યારે બાટલીને કદી ભૂલતા નહીં. બાટલીને હંમેશા પોતાનું જ ટાઈન ગણેલું.

જ્યારે કુલુલ અકતાબ હઝરત શાયખ મુહમ્મદ ઝકરિયાહ રહ. ક્રિટનમાં તારીફ થાવા અને મૌલાના મોતાલા સાહેબ સમજ ક્રિટનમાં છોકરીઓની અલગ શાયા શરૂ કરવાના વિચારો રજૂ કર્યા ત્યારે મૌલાનાએ કહેલું કે આ કામ બાટલીવાળા જ કરી શકશે અને એ માટે બાટલીના અગ્રણીઓને બરી ખાતે બોલાવેલા અને ઉત્સાહ પ્રેરવા પાંચ પાઉન્ડની નોટ આપેલી. જો કે ઈન્દિયા મુસ્લિમ વેલ્ફેર સોસાયટીએ પ્રવાસ કરેલો પણ કોઈક કારણસર એનાથી એ કાળને અંજામ અપાવેલો નહીં. અને પછી થોડાક ભાઈઓએ એમના જ નામે બાટલી ખાતે ઝકરીયા મુસ્લિમ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના કરેલી.

આજથી પાંચત્રીસ વર્ષ પહેલાં ઘરૂલ ઉલૂમમાં નાણાંકીય કટોકટી ઊભી થયેલી. નાણાંની સખત તંગીના કારણે બિલ્લો વગેરે ભરવાની મુશ્કેલી ઊભી થયેલી. ત્યારે મૌલાનાએ એ માટે લંડનમાં જસ દિવસ ચંદો કરવાનો કાર્યક્રમ ઘોષેલો. એ કામ માટે બાટલીથી આઠ દસ માણસોની એક ટીમ મોકલવાની જવાબદારી મૌલાના ઐયુબ સાહેબ રહ. ને સોંપેલી અને બાટલીથી આઠ દસ જણાં લંડન જસ દિવસ માટે ગયેલા અને સખત મહેનત કરી એક મોટી રકમ એકઠી કરેલી.

ઈન્દિયાન મુસ્લિમ વેલ્ફેર સોસાયટીએ વોસ્વીક રોડ ઉપર આલેલી સરદાર મિલ્લ મરીદવાનું નક્કી કર્યું. એ માટે એક મોટી રકમની આવશ્યકતા હતી. જે માટે એક માહોલ તૈયાર કરવાની જરૂર

હતી. તે માટે મૌલાના બાટલી અલેલા અને એક જંગી સભાને સંબોધન કરેલું અને એક માહોલ તૈયાર થયેલો. બીજા વર્ષે એરિયાનું વિભાગીકરણ થતાં સરદાર મિલ્લનું મસ્જિદ-મદ્રેસામાં રૂપાંતર કરવામાં એ એરિયાની કમિટીની મહેનતથી એક સુંદર મસ્જિદ અને મદ્રેસાનું અસ્તિત્વ થયેલું.

જ્યારે જ્યારે બાટલીને મૌલાના સાહેબની સલાહની જરૂર થઈ ત્યારે મૌલાના બાટલીને પોતાનું ગણી સલાહ-સુખનો આપતા. મૌલાના જેવા કોમના સિતેરુ હવે પછી મળવા મુશ્કેલ છે. કોમની ફિકર અને કોમ પ્રત્યેની લાગણી એજ એમનું સમજાવનન. અલ્લાહપાક એમની તમામ મિદમ્તોને કમુલ કરવાની જરૂરુલ ફીરદોલમાં આલા મકામ અતા કરે આવીન.

**હઝરત મૌલાના યુસુફ મોતાલા (રહ.) ની
સાદમાં એક સભાનું આયોજન**

તારીખ ૧૫મી સપ્ટેમ્બર ૨૦૧૯ રવિવારના અલ ક્રિકમાહ સેન્ટર બાટલી ખાતે ઈન્દિયાન મુસ્લિમ વેલ્ફેર સોસાયટી, બાટલી અને સબ્લા ઉસ્માના સંબુદત સહકારથી હઝરત મૌલાના યુસુફ મોતાલા (રહ.)ની સાદમાં એક સભાનું મૌલાના ઈબ્રાહીમ નૌસારકા સાહેબના પ્રમુખ જ્ઠે આયોજન કરવામાં આવ્યું હતું. સભાજનોથી હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો.

અસરની નમાઝ બાદ કારી સઈદ માકલ સાહેબની ખુશ ઈશ્લામ કિરમતથી પ્રોઝામની શરૂઆત કરવામાં આવી હતી. તે પછી જામે મસ્જિદ સેનરી સ્ટ્રીટ, બાટલીના ઈમામ મૌલાના મોહમ્મદ મોટા સાહેબે હઝરત મૌલાના મોતાલા રહ. ની જીવન કારકીર્દી પર રોજની નાંખી હતી અને કહ્યું હતું કે, હઝરતને અલ્લાહથી, નથી સ.અ.વ. થી અને એમના શાયખ હઝરત ઝકરીયા રહ. થી વેલ્ફેર અકીફત અને મોહબ્બત હતી. ત્યારબાદ મૌલાના શોકત દાદીવાલા સાહેબે મૌલાના રહ.ની જીવન કારકીર્દીનું બચાન અત્યંત દર્દમય અવાજમાં કર્યું હતું અને આખી સભા ગમગીનીમાં ઢૂલી ગઈ હતી. તે પછી કદી વસીલિલ્લાહ સાહેબે મૌલાના અબુલહવ સીદાત, નાદિર લાજપુરી રચિત નઝમ " બહા મુલ્કાર વો મકામે બરી હે " સુંદર તરજુમથી રજૂ કરી સભાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ત્યારબાદ ઈકબાલ ભાણાએ ટેલીકોમ્યુનીકેશન (રીસીવર)ની સ્થાપના કરવા પહેલાં હઝરત મૌલાના રહ.ની સલાહ મથેરા લીલાની વાતો રજૂ કરી હતી. આજે એ સીસ્ટમ ક્રિટનની મોટેભાગની મસ્જિદમાં કાર્પસ છે. ત્યારબાદ ડો અબ્દુરરહમાન રાજપુરા સાહેબે મૌલાના સાહેબ સાહેબા ગઠ સંબંધો અને માઉન્ટ પ્લેઝન્ટ મસ્જિદ-મદ્રેસાના બાંધકામવેલા એના નામો, જગ્યા વગેરે માટે મનેલ સલાહનું સુંદર વર્ણન કર્યું હતું.

ત્યારબાદ મૌલાના ડો. ઈબ્રાહીમ દાદીબાઈએ પોતાની આગલી સૈલીમાં કહ્યું હતું કે, હઝરત મૌલાના રહ. માત્ર યુ.કે.નાજ નહીં પરંતુ પુરા યુરોપ, આફ્રિકા, અમેરિકા, કેનેડાના ઈમામ બનીને આવ્યા હતા. એમના શાગીર્દો વિશ્વભરમાં ફેલાઈને અનેક દારૂલ ઉલૂમો શરૂ કરી ઈન્દિયા તાલિમનો ફેલાવો કરી રહ્યા છે. તે પછી
(આગળના પાના ઉપર)

અહમદ સુલે હઝરત મૌલાના રહ. નો બાટલી અને ઈન્ડિયન મુસ્લિમ વેલ્ફેર સોસાયટી સાથેના ગાઢ સંબંધોના ઘોડાક પ્રસંગોની રજૂઆત કરી બાટલી પ્રત્યે હઝરતની મોહબ્બત અને શાખાણીનું વર્ણન કર્યું હતું.

ત્યારબાદ મદીના અહમદીના બાની મૌલાના મલીક અહમદ કાઝી સાહેબે જણાવ્યું હતું કે, આજે બધા અહીં કમાણી માટે આવ્યા હતા. જ્યારે હઝરત મૌલાના રહ ભરતુવાનીમાં અહીં આવી ઉમ્મતની ફીકર કરી હતી. એક જંગલ જેવા સ્થળે દારૂલ ઉલૂમની સ્થાપના કરી હતી. હઝરતે એમના જીવનમાં ૨૭ જેટલી કિતાબોનું સંકલન કર્યું હતું તેની માહિતી આપી હતી. તે પછી મૌલાના શોએબ પટેલે મૌલાના નાદિર લાજપુરીએ હઝરતના ઈત્તેકાલ પછી લખેલી નઝમ "સુકુને કલ્બ થા સબકે લીયે દિદારે યુસુફકા" ની તરતુમથી સુંદર રીતે રજૂઆત કરી સભાને ભાવવિભોર કરી દીધી હતી.

તે પછી મૌલાના રઉફ સાહેબે પોતાનો સમય મૌલાના ઈસ્માઈલ રાજા સાહેબને આપી દેતા એકદમ ટૂંકમાં પ્રસંગોપાત વાતો રજૂ કરી હતી. અને તે પછી મૌલાના ઈસ્માઈલ રાજાએ સમગ્ર બયાન ગદગદ કંઠે રજૂ કર્યું હતું. સદમો એટલો તાજો છે કે શું કહેવું એજ સમજાતુ નથી ખૂબજ ભાવનાત્મક રીતે મૌલાના રહ. ના જીવન મુબારકની રજૂઆત કરી હતી. ઉપરાંત બ્રડફોર્ડ ખાતે છોકરીઓનો દારૂલ ઉલૂમ (મદ્રેસા ઈમામ મહંમદ ઝકરીયા) ચાલી રહ્યો છે તે તથા બાટલી-ડયુઝબરી ખાતે મદ્રેસા મરકઝૂલ ઈલ્મી જેનું સંચાલન મૌલાના ઈસ્માઈલ રાજા કરી રહ્યા છે તેની સ્થાપના અને તે કામમાં મૌલાના રહ. ની દરેક સલાહ, સૂચનો અને મર્હમની એમાં કાબેલીયતની વાતો કરી હતી. મુક્તી મુસા બદાત સાહેબ દા.બ. નાદરસ્ત તબિયતના કારણે હાજર રહી શક્યા ન હતા. એમણે હઝરત મૌલાના રહ. ના ઈત્તેકાલ પર દિલાસાનો સંદેશ પાઠવ્યો હતો.

તે પછી ઈન્ડિયન મુસ્લિમ વેલ્ફેર સોસાયટીના ચેરમેન ડો. ઈન્તિયાઝ પટેલે બન્ને સંસ્થા વતી વક્તાઓનો અને સભાજનો તથા પ્રોગ્રામને સફળ બનાવવા મહેનત કરનારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અને છેવટે મૌલાના રઉફ સાહેબની દુઆથી એક ખૂબજ સફળ સભાની સમાપ્તિ થઈ હતી. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન મૌલાના યુનુસ પટેલ સાહેબે એટલી સુંદર રીતે કર્યું હતું કે એમના સંચાલનમાં એક પરિપક્વ સંચાલકની ઝલક દેખાતી હતી. આ પ્રોગ્રામ એ રીતે યાદગાર રહેશે. ૧. હઝરત મૌલાના રહ.ની મોહબ્બતમાં હાજરજનોથી અલ હિકમાહ સેન્ટરનો હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. ૨. પ્રોગ્રામ સમયસર શરૂ થયો. નક્કી કરેલા સમયમાં પૂરો થયો. ૩. વક્તાઓએ પોતાના વક્તવ્ય માટે પાઠવેલ સમયનો પૂરો ખ્યાલ રાખ્યો હતો.

ભારતમાં મંદી અને આર્થિક કટોકટી

ભારત ખાતે હાલમાં મંદીની સમસ્યા સર્જાઈ છે. ઓટો સેક્ટરમાં મોટી ગીરાવટ આવતા વાહનો બનાવતી ફેક્ટરીઓમાં વાહનો ના ઢગલા ખડકાય રહ્યા છે, જેનું કારણ છે લોકો પાસે પૈસાની

અછતના પરિણામે કોઈ પણ સ્કૂટર કે કાર ખરીદવા અશક્તિમાન છે. જેથી કાર ઉત્પાદકોને મોટો ફટકો પડ્યો છે. પરિણામે કેટલાય પલાન્ટમાં ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. અને અસંખ્ય કામદારો બેકાર બની રહ્યા છે. અનેક શો રૂમો બંધ થઈ રહ્યા છે. આ ઉપરાંત કાપડ ઉદ્યોગ અને નાના ધંધાઓ ઉપર પણ મંદીની અસર પડવાથી નોકરીઓ જઈ રહી છે. બેકારીનું પ્રમાણ પહેલાથીજ વધુ છે તેવામાં આ પરિસ્થિતિથી નીચલા અને મધ્યમ વર્ગને વધુ નુકસાન થતું જોવા મળે છે.

દેશની અર્થવ્યવસ્થા ડામાડોલ થવાથી વિદેશી રોકાણકારો પણ તેમની મુંડીઓ કાઢી લઈ અન્ય દેશમાં ઈન્વેસ્ટ કરી રહ્યા છે. અર્થવ્યવસ્થા અને ડેફીસીટને કન્ટ્રોલ કરવા સરકાર જૂદા જૂદા ટેક્ષોમાં વધારો કરી રહી છે. હાલમાં ટ્રાફીક નિયમોનું ઉલંઘન કરનારને ભરવા પડતા દંડમાં પાંચ થી ૧૦ ગણો વધારો કરી તેને કડક રીતે અમલમાં મુકવા રાજ્ય સરકારોને દબાણ કર્યું છે. પરંતુ વધારો એટલો છે કે રાજ્ય સરકાર તેને લાગુ કરવા વિરોધ કરી રહી છે. કેન્દ્ર સરકાર આવા ટેક્ષોથી પોતાની તિજોરી ભરવા માંગે છે પરિણામે વાહન ચાલકોને પોલિસ તરફથી કનડગત અને ભારે દંડનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારની દરેક નીતિઓ નાકામયાબ થતી જોવા મળે છે જેથી તે વારંવાર પોતાનાજ કાયદાઓ અને નીતિથી યુ ટર્ન કરી રહી છે.

મૌલાના યુસુફ મોતાલા રહ. ની વફાત પર

સુકુને કલ્બ થા સબકે લીયે દિદાર યુસુફ કા
 યહાં છોટા બડા હર કોઈ થા બિમાર યસુફ કા
 બીલા શક કાસિમે સાની થા યુરોપ કે લીયે યુસુફ
 યહી કેહનેકો બસ એક નામ થા હકદાર યુસુફ કા
 પડા થા મુદતો તક જંગલોમે બે સરો સામાન
 અજબ થા દેખને મે જઝબએ ઈસાર યુસુફ કા
 અમલ કે ફૂલ સે તો ઈલ્મ કે લાલ વ જવાહિર સે
 ફીર આઠો પહર રેહતા લગા બાઝાર યુસુફ કા
 હિમાલા ભી લરઝ જાયે થા એસા હોંસલા ઉસમે
 જમાના કર યુકા થા ઈન્તેહાન સો બાર યુસુફ કા
 હકીકત સામને આ જાતી ખુલકર આને વાહિદમે
 અજબ અંદાજ હોતા થા દમે ગુફતાર યુસુફ કા
 ન જલ્લે હુકમરાનીકે, ન તપ્ત વ તાજ થા ફીરભી
 ન થા કમ શાહી દરબારોસે કુછ દરબાર યુસુફ કા
 કભી એક બાર ભી મિલતા જો યુસુફસે તો ફીર ઉસકો
 હંમેશા યાદ રહેતા થા ખુલુસ વ પ્યાર યુસુફ કા
 સુનેહરે હર્ફ સે તારીખમે યે લીખા જાયેગા
 નમુના થા ઝમાનેકે લીયે ફીરદાર યુસુફ કા
 દુઆ ભી હૈ મેરી અલ્લાહ સે ઉમ્મીદ ભી નાદિર
 રહેગા લેહલેહાતા હમ્મ તક ગુલઝાર યુસુફ કા

-હઝરત મૌલાના અબ્દુલહય સિદાત
 નાદિર લાજપુરી, ભાટલી.

ડિવોર્સ (છૂટાછેડા)

-આભિદાનેન રાજપુરા, ભાટલી.

યોવનનો પ્રારંભ થતાં, યુવક-યુવતિઓમાં પ્રેમ આપવા તથા પ્રેમ પામવા માટેની ઉત્તેજના શરૂ થાય છે. વડીલોની દોરવણીથી કે પોતાની પસંદગીથી જીવનસાથી મેળવી લગ્નના બંધનમાં બંધાઈ જિંદગીના નવા પ્રકરણની શરૂઆત થતી હોય છે. કુટુંબીજનો સાથે સારી રીતે રહી, એકબીજાને સુખી કરવાના વચનોની આપલે થતી હોય છે.

સમજદાર અને સહનશક્તિવાળા પતિ-પત્ની ગમે તે સમસ્યા આવે તેને ઉકેલીને જિંદગીને સરળ અને સુખી બનાવી શકતા હોય છે. પરંતુ ઘણીવાર વ્યક્તિત્વના કલેશ, અધિરતા, અહમ, જીદ, ગેરસમજ વગેરેને લીધે નાની મોટી બાબતોમાં દલીલો, ઝઘડા શરૂ થઈ જાય છે. કોઈને પોતાની વ્યક્તિગત બાબતમાં નિવારણ (સોલ્વ) કરવાને બદલે પોતેજ છૂટા પડવાનો નિર્ણય લઈને બંને તરફના કુટુંબોને આઘાત આપતા હોય છે. તેમાંય જો બાળક હોય તો તેની નિયતિ દયાજનક બને છે.

એક રમતલ ઘર કલહ-કંકાસથી તૂટી પડે

એની ઈંટોથી પ્રથમ સંતાન ઘાયલ થાય છે.

છૂટા પડવાનું, ડિવોર્સ લેવાનું પ્રમાણ અહીં તથા ઈન્ડિયામાં વધી રહ્યું છે. બીબીસીના ન્યૂઝ પ્રમાણે યોર્કશાયરમાં આ પ્રમાણ સૌથી વધારે છે. આજથી બે દાયકા પહેલાં “ડિવોર્સ” શબ્દ ભયાનક લાગતો અને તેમ કરનારની ટીકા થતી. પણ હવે તે સામાન્ય બાબત બની ગઈ છે. છૂટા પડનાર યુગલોની એવી દલીલ હોય છે કે, “અમે બહુ પ્રયત્ન કર્યા પણ મેળ પડે તેમ નથી, અમારું સાથે રહેવું અશક્ય છે.” અહીં સવાલ થાય છે કે, “બધા પ્રયત્નો” ની વ્યાખ્યા શું છે? ઘણીવાર આ અંગેના નિર્ણયો ઉતાવળિયા હોય છે.

લગ્ન પહેલાના સમયગાળામાં રોમાન્સની દુનિયામાં ખોવાયેલા યુગલો એકબીજાને ચાહીને, સમજીને, એકબીજાની અપેક્ષાઓ પૂરી કરીને ગમે તેવી પરિસ્થિતિમાં સાથે રહીને સુખી બનવાના વચનો આપતાં હોય છે. પરંતુ આ બાબતો ઉપર મક્કમ ન રહેનાર યુગલો લગ્નની પરિસ્થિતિમાં “નાપાસ” થતાં હોય છે. જુદા જુદા વાતાવરણમાં ઉછરેલી બે વ્યક્તિઓ બધી રીતે અલગ હોઈ શકે પરંતુ નવા માહોલમાં અજાણ્યાં કુટુંબીજનો સાથે “એડજસ્ટમેન્ટ”નો પડકાર ઝીલવાવાળા લગ્નની સફળતા મેળવી શકે છે. લગ્નની વાસ્તવિકતા સમજીને સમજદારી અને સમર્પણની ભાવના સાથે જવાબદારીભર્યું જીવન જીવવાની માનસિક તૈયારી ના હોય તો આવી સમસ્યાઓ ઊભી થતી હોય છે.

લગ્ન જીવન એક પડકાર સમાન છે. જેમાં પોતાની ભૂલ હોય તો સ્વીકારવાની હિંમત હોવી જોઈએ. બીજાની ભૂલ હોય તો બાંધછોડ કરવાની તૈયારી હોવી જોઈએ. મુંઝવણ કે સમસ્યાઓ શરૂ થાય ત્યારથીજ તેનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવા, જરૂર પડે તો મિત્રો, વડીલો કે સગાંની સલાહ લેવી જરૂરી બને છે. ઘરની ચાર દિવાલો વચ્ચે દલીલો કરવી અને બહાર નીકળે ત્યારે

જાણે કંઈ થયુંજ નથી તેવો દેખાવ કરવો એ સમસ્યાનો ઉકેલ નથી.

લગ્ન પહેલાં મા-બાપ સાથેની જિંદગીમાં કોઈ જાતની જવાબદારી હોતી નથી પરંતુ લગ્ન પછી પતિ-પત્ની બંનેએ પોતાની આદતો, રહેણીકરણી જરૂર પ્રમાણે બદલવી પડે છે. પોતાનું મનમાન્યું કરવાની ટેવ, ઘરકામની સૂગ, રસોઈની અણઆવડત, મોડા ઉઠવાની આદત વગેરે થોડા દિવસ ચાલે પણ આવું કરનાર દીકરીએ પોતાની આદતો સુધારવાની ખૂબ જરૂરી બને છે. ઘણીવાર આવી નાની બાબતો ગંભીર સ્વરૂપે પ્રશ્નો ઊભા કરે છે.

કેટલાક સંજોગોમાં ભણાતરનું કે પૈસાનું અભિમાન પણ સંઘર્ષનું કારણ બને છે. નોકરોની વચ્ચે ઊછરેલી કન્યા તેની સાસુને સલાહ આપે કે, “તમે એક નોકર કેમ નથી રાખી લેતા? મારાથી આ કામ નહીં થાય.” આવા શબ્દોથી મનદુઃખ ઊભું થાય છે. ક્યારેક એવું પણ બને કે, ભણાતરમાં ૨૦-૨૨ વર્ષ પૂરા કરીને આવેલી વહુને કામ કરવું હોય પણ આવડતું ના હોય તો સાસુ ટોણા મારે કે, “તારી મા એ તને કંઈજ શીખવ્યું નથી.” આ શબ્દોથી અપમાનિત વહુને સાસુ માટે માન રહેતું નથી અને પછી દલીલો શરૂ થાય છે. હોંશથી શીખવાની અને પ્રેમથી શીખવાડવાની તૈયારી અહીં જરૂરી છે.

સંયુક્ત કુટુંબમાં આ પ્રમાણેના પ્રશ્નો ઊભા થાય છે. પરંતુ હવે તો એકલા રહેનાર યુગલો પણ પોતાની મનમાની કરી ઝઘડાઓ કરતા હોય છે. એકબીજા તરફનું માન અને ભરોસો તૂટી જાય પછી બંનેને એકબીજાની ભૂલો જ દેખાતી હોય છે. મનભેદ કે મતભેદ દૂર કરવા બાંધછોડની તૈયારી રાખવી જરૂર હોય છે. કોઈપણ શંકા કે વહેમને નિખાલસતાથી ચર્ચા કરીને દૂર કરવાથી ઝઘડો આગળ વધતો અટકે, પરંતુ આજકાલ ધીરજ અને સમજના અભાવે જુવાનીયાઓ પોતાના નિર્ણયો લેવાની ઉતાવળ કરી બેસે છે અને છૂટા થાય છે.

ભૂલી ગયો

બેડ ચાખીને તું સૂકો રોટલો ભૂલી ગયો
ચૂસતો તો કેરીનો તું ગોટલો ભૂલી ગયો.
પોચા પોચા બેડ પર આરામ લઈને તું હવે
તૂટેલો કાઢીનો પેલો ખાટલો ભૂલી ગયો.
સ્નાન કરવાનું મળ્યું ટબબાઘમાં બેસી અહીં
એટલે તું ચોકડીનો પાટલો ભૂલી ગયો.
ફાનસ નથી સળગાવવી પડતી અહીં તેથીજ તો
ધાસતેલ લેવા જવાનો ખાટલો ભૂલી ગયો.
સુટ પહેરીને ફરે છે કેટલો ઊંચો હવે
પહેરીને ફરતો હતો બૂટ ફાટલો ભૂલી ગયો.
તું રમે છે આજ તો બીન્ગો કસીનોમાં રમત
કોડીઓ રમતો હતો તે ઓટલો ભૂલી ગયો.
ઈંગ્લેન્ડની મેમના બોબરેર જોઈને સૂફી
તું હવે તો બોલવાનું ચોટલો ભૂલી ગયો.

-મર્દુમ સૂફી મગુબરી, બોલ્લન.

بریکنگ نیوز: برطانوی وزیراعظم بورس جانسن نے ملکہ برطانیہ سے جھوٹ
بوتلے کی تردید کر دی

برطانیہ کے وزیراعظم بورس جانسن نے اس بات کی تردید کی ہے انہوں نے ملکہ برطانیہ کو
ملک کی پارلیمنٹ کو پھینچنے تک مسئلہ رکھنے کا مشورہ ہے۔ چند وقت پہلے جھوٹا کاہنہ لیا تھا
بورس جانسن کا یہ بیان ایسے وقت میں سامنے آیا ہے جب سکاٹ لینڈ کی اعلیٰ ترین عدالت
نے پارلیمنٹ کو مسئلہ کرنے کے فیصلے کو غیر قانونی قرار دے چھوئے کہا ہے کہ وزیراعظم
بورس جانسن نے پارلیمنٹ کی مسئلہ کے معاملے سے ملکہ برطانیہ کو گمراہ کیا تھا۔ جب بورس
جانسن سے سوال ہوا کہ آیا انہوں نے مسئلہ کی وجہ سے عدالت کو کتے وقت ملکہ سے جھوٹ
بولتا تھا تو ان کا جواب تھا ہاں نہیں انہوں نے مزید کہا کہ انگلینڈ کی پارلیمنٹ کا خارجہ
پریم سے متعلق ہے۔ ۲۰۱۴م آئری لینڈ پر بم کوٹ کو کرہ بھگا برطانوی قوانین کے تحت
پارلیمنٹ کو مسئلہ کرنے کا مشورہ ملکہ برطانیہ کے پاس ہے۔ عدالت کی طرف سے اس معاملے سے
وزیراعظم کی جہت سے یہ فیصلے کیے ہوئے ہیں۔ ملکہ برطانیہ کے وزیراعظم بورس
جانسن نے ایک صفحہ فیصلے میں قرار دیا تھا کہ وزیراعظم کے اس فیصلے کے پیچھے
پارلیمنٹ کی ترقی کو روکنے کا نصاب مقصد ہے۔ لیکن 70 ممبران پارلیمنٹ کی
جہت سے پارلیمنٹ کی مسئلہ کے فیصلے کے خلاف دائر کی گئی ایک درخواست پر آیا ہے اس
فیصلے پر بات کرتے ہوئے بورس جانسن کا کہنا تھا کہ یہ ایک ناقابل عمل نعرہ ہے۔ یہ اقدام
جمہوریت کو کمزور کرنے کی کوشش تھا۔ انہوں نے مزید کہا کہ جے آئی کے عدالت وزیراعظم
کے لیے اس اوجھلے کے اختلافات کو ایک عام کی بات ہے۔

آپ بھرا میں جہد ملی: سٹیج سمندر تجزی سے بلند ہو رہی ہے

یورپک میں اقوام متحدہ کے نام ڈاکو سے ملے آپ بھرا میں جہد ملیوں نے شروع ہونے
تلازمہ ترین تحقیق میں کہا گیا ہے کہ حالیہ مدت کی طوائف اور اثرات تجزی سے ظاہر ہو
رہے ہیں۔ جو سمیت کے مالی ادارے (ڈیٹا ایچ) کے مرتب کرنا اور عدالت کے مطابق
سہ 2014 سے لے کر سہ 2019 تک کا پانچ سالہ عرصہ دکھانے کے اجراء سے سب سے
گرم تھا۔ اس وقت کے دوران سٹیج سمندر کے اغاٹے میں نمایاں طور پر تجزی آئی ہے
کیونکہ کلینڈر ڈائیگرام کے اغاٹے نے قیادتوں کو گھوما ہے۔ ڈیٹا ایچ کا کہنا ہے کہ
کلینڈر کے اغاٹے کو کم کرنے کی کوششوں کو فوری طور پر ختم کرنا ہو گا۔ یہ بیان حالیہ برسوں
میں مالی مدت میں بہ شکل اغاٹے کی وجہ سے اثرات ہی ہونے والی تازہ ترین سائنسی
تحقیق کا مجموعہ ہے۔ تحقیق میں تسلیم کیا گیا کہ سہ 1850 کے بعد سے حالیہ دور مدت
میں 1.1 ڈگری سنٹی گریڈ اضافہ ہوا ہے۔ سہ 2011 سے 2015 کے درمیان
0.2 سنٹی گریڈ تک بڑھ گیا ہے۔ سب سے پریشان کن ہوا اور شدید سٹیج سمندر میں
اغاٹے کے ہیں۔ سہ 1993 کے بعد سے ایک اغاٹے کی اوسط شرح ہر سال 3.2 ڈگری
میٹر ہے۔ سہ 2014 سے 2019 تک یہ اضافہ ہر سال پانچ ڈگری میٹر تک بڑھ گیا
ہے۔ سہ 2007 سے 2016 کے دوران برسوں کی مدت میں یہ اضافہ اوسط ہر سال چار ڈگری
میٹر کے حساب سے دکھایا۔

ڈیٹا ایچ کے تجزیہ میں جہد ملیوں نے کہا ہے کہ سٹیج سمندر کے اغاٹے میں ہوا ہے اور
میں مدد ہے کہ اضافہ کل ہوا کرین لینڈ کی ہوا کی تھوں میں پانچ کی سطح میں
ہوا کا کہہ سکتے ہیں اس کے وہ کہ سٹیج سمندر کی سطح تجزی سے ہوا کرے گی۔

اثرات یہاں سے سڑکوں میں دیکھے کہ اس سے سٹیج سمندر میں اضافہ ہو جس کی وجہ سے
لاہکی طوائف آئے جو تھائی لینڈ اور ماسی جہاں کا باعث ہے اس تحقیق میں سمندروں کو
لاحق طوائف کی مدد ملتی ہے۔ آپ بھرا میں جہد ملیوں کے باعث مدت میں
سہ 90۷ لاکھ سمندروں میں ہوا ہے۔

بحین سعودی عرب: اقوام متحدہ کی جانب سے حوثی باغیوں کے سعودی
عرب پر حملے کرنے کی پیشکش کا شہر مقدم

اقوام متحدہ نے بحین میں ایران کے حملے پر حوثی باغیوں کی جہت سے ایک امن بیان
کے تحت سعودی عرب پر تمام حملوں کے خاتمے کی تجویز کا شہر مقدم کیا ہے۔ اقوام متحدہ کی
جہت سے جاری ایک بیان میں کہا گیا ہے کہ اس تجویز سے جنگ کے خاتمے کی عوامل کا
خاتمہ عام ہو گا۔ سٹیج سمندر میں کہا گیا ہے کہ حوثی باغیوں کی جہت سے سعودی عرب کی مل
تھیں اور کوہستان میں عراقی حملوں سے لگاتار ملنے کے ایک نئے دور کی گئی ہے۔
یورپ کے حوثی باغیوں نے اس حملے کی ذمہ داری قبول کی تھی۔ لیکن امریکہ اور سعودی
عرب نے اس حملے میں ایران کو ملوث قرار دیا ہے۔

بحین جنگ: سعودی اتحاد کی پہلی سے 100 سے زائد اہل ہلاک

عالمی سلامتی کونسل نے سعودی اتحاد کی پہلی سے 100 افراد ہلاک ہو گئے ہیں۔ آئی سی آئی کے
مطابق ہلاک کردہ ہونے والے اس حملے کے ہلاک 40 ممبروں کا علاج جاری ہے۔
مطابق ہلاک کے مطابق انہوں نے مدت کے چھ ممبروں کی ہلاک کی آواز میں تھی۔

سعودی اتحاد کا کہنا ہے کہ بحین کے شہر دمام میں ایک ہلاک ہوا اور عراقی کے لڑے کو ہلاک کیا گیا
ہے جبکہ حکومت قطر حوثی باغیوں کے مطابق اس حملے میں ایک عراقی مرکز کو نشانہ بنا
گیا ہے۔ آئی سی آئی کے مطابق دمام عراقی مرکز سے لگے ہلاکات کر
چکے ہیں۔ بحین میں اہل کھلی کھلی آواز ہے کہ اس کے سربراہان اور فیڈریشن نے کہا ہے کہ
ان کی تنظیم ہلاک اور سے شاخیں ختم کر دی ہے لیکن مزید کسی شخص کے ذمہ لے کے

انکارتا جہاں کہیں۔ بحین سہ 2015 سے جنگ جاری ہے۔ یہ علاقہ اس وقت
شہر ہے اور اتحادی حوثی باغیوں نے دارالحکومت منشا کو قبول سنبھال کر حکومت کا چھو
اٹھ دیا تھا۔ بحین میں سعودی عرب کی قیادت میں تقریباً دو لاکھ حملے کیے جاتے ہیں
جبکہ حوثی باغی اکثر سعودی عرب پر عراقی حملے کرتے ہیں۔ بحین میں جاری جنگ کی
وجہ سے صحت کی سہولیات شدید متاثر ہوئی ہیں۔ اس جنگ ذمہ دار تقریباً ایک کروڑ
افراد اور کے طور پر فراہم کی جانے والی خوراک کا نقصان ہے۔

اقوام متحدہ کے اعداد و شمار کے مطابق بحین میں سہ 2016 سے ہلاک اس جنگ کے نتیجے
میں اب تک تقریباً 70 ہزار لوگ ہلاک ہو چکے ہیں۔

چراغ زندگی اور گافروز بہ ہم نہیں ہو گئے

پائی کرہ انجمن صوفیہ لاہور کی ہوائی برطانیہ

بڑوں میں سال بزرگسائی کے نوری پہ پہلی ہے

بڑی مشکل سے جہاں سے گانا میں دیکھ رہا ہوں

وہی کابل حضرت مولانا غلام صاحب کے وہاں کی تحریر کر کے انگریزوں کی جنگ بھی
ناہنے پائی تھی اور حضرت کے انتقال کا سو دن پہلی صبح کے دنوں سے پہلا بھی نہیں
پاسے تھے کہ برطانیہ کے قلب فتح اللہی حضرت مولانا صاحب کے وہاں سے حضرت صاحب کے انتقال کی
خبر کھڑے آئی۔

سوہتاں کی ہے یاد کہ جس میں افسوس

وہاں سے واپس بھی آتے ہی ہلنے کے لئے

آپ کی پیدائش عرصہ ۱۳۲۶ھ بمطابق ۱۹۰۸ء میں ۱۳۲۶ھ بمطابق ۱۹۰۸ء میں ۱۳۲۶ھ بمطابق ۱۹۰۸ء میں
ہوئی اور آپ کی تعلیم مدرسہ عربیہ اسلامیہ میں حاصل کی۔ ۱۳۶۱ھ میں مدرسہ
کے مشیر مدرسہ میں داخل ہوئے لیکن تک اسی مدرسہ سے تعلیم حاصل کی۔
پھر ان مشاہیر اہل علم سے تشریف لے گئے۔ حضرت مولانا صاحب نے صاحب سے
مشاورت فرمائی۔ لیکن مولانا صاحب سے اور ہمارے جانشین مولانا صاحب کی
صاحب سے فرمائی۔ ان کے بعد مولانا صاحب نے حضرت مولانا صاحب سے صاحب سے
سے اور ترقی ترقی اور مسلم شریف حضرت مولانا صاحب نے صاحب سے صاحب سے
طوبی شریف حضرت مولانا صاحب نے صاحب سے صاحب سے صاحب سے صاحب سے
فتح اللہی حضرت مولانا صاحب نے صاحب سے صاحب سے صاحب سے صاحب سے
وہاں تعلیم حاصل کی اور اس کے بعد مولانا صاحب نے صاحب سے صاحب سے صاحب سے
ذکر مولانا صاحب نے صاحب سے صاحب سے صاحب سے صاحب سے صاحب سے صاحب سے
پتلیا بھ سلسلہ میں حضرت کو داخل فرمایا۔

ہر جہ جگہ جس کو مل گیا

ہر قسم کے دانتوں کا کام کہاں؟

۱۳۸۹ھ میں حضرت شیک اللہ قادری صاحب نے صاحب سے صاحب سے صاحب سے صاحب سے
گئے اور وہ کہہ کر۔ میں قیام لایا اور آخری عمر میں صاحب نے صاحب سے صاحب سے
نہی میں وہاں صاحب نے صاحب سے صاحب سے صاحب سے صاحب سے صاحب سے
دلہا اہل علم کو ہی تھی آپ کی ضرورت
تھی ذات آپ کی دلچسپی تھی بڑی قیمت

قلب صاحب حضرت مولانا صاحب نے صاحب سے صاحب سے صاحب سے صاحب سے
کے مسلمانوں کو روکنا نہیں حاصل ہوا۔ برکت کا بعد مولانا صاحب نے صاحب سے صاحب سے
وہ برطانیہ علم کی صورت سے صاحب سے صاحب سے صاحب سے صاحب سے صاحب سے
موسوم ہوا اس کے بعد برطانیہ میں ہر جگہ صاحب نے صاحب سے صاحب سے صاحب سے
ہے آپ انجمن صوفیہ لاہور کی پیدائش میں
میتا نے کہا ہے جا کر خاک آسیدہ کھری

حضرت ابو سعید خدری سے تیری فہم روزی ہیں بلبل

فہم سے تیرے چہرے اس پر شہسوار ہر خاص

پورے گانہ تیری زبان عنایت کو

بھول نہ پائے کہ وہ تیرے سامان کو۔

برطانیہ کی سپریم کورٹ: برطانوی پارلیمنٹ معطل کرنا غیر قانونی تھا
برطانیہ کی سپریم کورٹ کے گیارہ ججوں نے معطل ہونے کے بعد اس سے برطانوی وزیر
اعظم ہر س ہانس کے پارلیمنٹ معطل ہونے کا اہم اس بات کو غیر قانونی قرار دیا
قرارداد سے کہہ کر ہر اقدام قانونی طور سے غیر موافق قرار دیا اور ہانس نے
اس کے باوجود اس بات کو پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
تھی ہانس نے ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
بریکٹ سے نکل کر ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
ہانس کی ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
وزیر اعظم نے اپنے فیصلے کو عمل میں لایا کہ اس کے لیے معطل ہونے کی ضرورت نہیں
چند دنوں کے اندر ہی ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
دلہا ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
موقف تھا کہ ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
کرنے کے لیے کہہ کر ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
بریکٹ میں ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
نیل کا ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
غیر قانونی قرار دیا کہ اس کا پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
عدالت کا ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
ہے کہ پارلیمنٹ کا ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
دلہا ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
کہ ایک صاحب نے ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
کے حکام کو ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
ہر جگہ حزب اختلاف کی عصمت لہر پڑنے کے سر پر ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
نے ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
ہر س ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
کورٹ نے ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
حکام ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
تھی ہانس کے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
عدالت نے پارلیمنٹ کے لیے معطل ہونے کی ضرورت نہیں سمجھی کہ وہ
قرارداد تھا۔

Download the FREE IMWS APP



includes!

Namaz times, Nikah Service link, Paigaam, An-nisa, Events, Course notices and much much more!!

HAJJ 2019	UMRAH IN DECEMBER	AL-AQSA
5 STAR PACKAGE ★★★★★ £5400 Rights included	ECONOMY PACKAGE £999 Rights included	5 STAR PACKAGE £1335 7 nights
Head Office 01924 453087 Contact 07868277820 (Mobile) 07894084377 (Home) 07976610121 (Work)	TAWAAF HAJJ & UMRAH TOURS DOWSBURY	Address 41 South St, Dowsbury WF12 9NB Email enquiry@tawaafl.co.uk

- Disposable plates and cutlery
- Hygiene and cleaning products
- Protective clothing
- Disposables (toilet rolls, centre feed rolls, hand towels etc)

FREE DELIVERY ANY AREA - SUBJECT TO MINIMUM ORDER

Telephone: 01274 305401 Mobile: 07976 207374
email: maypac@ntlworld.com

3 IN 1 offer

FREE 2nd pair **FREE tints**

and a **FREE** eye test

ADAMS OPTICIANS

41 SOUTH ST, SAVILE TOWN, WF12 9NB 01924 506446 / 07967 835886

Now enrolling. Call:
Moulana Shoayb Patel
07877 200456 / 01924 609646

SANATAYN

2 Years Adults Islamic Course for Brothers

Under the Guidance and Supervision of
Hadhrat Mufti Musa Badat Sahib (Hafizahullah)
 (Shaykhul Hadeeth & Khalifa of Faqeehul Ummat,
 Hadhrat Mufti Mahmood Hasan Gangohi Rahmatullahi Alayhi)

Ustaads:
Hadhrat Mufti Musa Badat Sahib (Shaykhul Hadeeth)
Mufti Hassan Mota Sahib (Ustaad of Hadeeth)
Mufti Hussain Mota Sahib (Ustaad of Hadeeth)
Mufti Saajid Badat Sahib (Ustad of Hadeeth)
Moulana Hasan Ebrahim (Ustaad of Tafseer)

Course starting after Ramadhan

Primarily Taught In English

Course comprising of:

1. Tafseer/ Translation of Qur'an
2. Hadeeth
3. Fiqh
4. Aqa'id
5. Seerah
6. Tajweed
7. Basic Aqal

Times:
Monday's & Wednesday's
6.00pm to 8.00pm

Venue:
Masjid -e- Mahmoodiyah /
Anjuman-e-Zinatul Islam
78 Taylor Street
Batley, WF17 5BA

Current Year 1 students:

"Sanatayn is an exceptional course which is deeply enlightening yet comprehensible. It has improved my knowledge, broadened my viewpoints, strengthened my faith and increased my confidence. The teachers are very inspiring and, the lessons are interactive and practical. I would recommend this course to any one, I wish, was introduced to it many years ago!"

Dr Mohammed AU Afridi
Consultant Psychologist

"Sanatayn has given me a taste of the oceans of knowledge which I need to still discover. Each lesson is a cherished moment with the experience and talented 'ustads'."

Yousaf Mulla
Businessman

"Sanatayn has enabled me to understand the Qur'an and Hadeeth under a great spiritual light. The teachers have a wealth of knowledge which makes the course an interesting, would definitely recommend it all."

Hafeez Zahariyya Baxter
Account Executive

A certificate will be issued after successful completion of the course.



Would you like to know of IMWS events, functions and courses taking place at the Al-Hikmah Centre?

Then drop us an email and we will add you to our monthly email bulletin!

email: info@imws.org.uk

with 'mailing list' in the subject field.

HIRE OF TAYLOR STREET (GIRLS) MADRESAH HALL

Members of AZI: £20 per hour

Non-Members: £30 per hour

An excellent choice for Engagements, Family Functions and other events

TWO SEPARATE LEVELS & ENTRANCES

For enquiries and bookings call:

Asif Lunat

07725 504 434

Yunus Laher/Lal

07877 854 595



FARUKS DECORATING



INTERIOR DECORATOR

- ◆ WALLPAPERING, ALL PAINT,
- ◆ LAMINATE, CLADDING
- ◆ JOINERY, KITCHEN FITTING,
- ◆ PLUMBING, TILING
- ◆ COVING, DADO RAIL,
- ◆ PICTURE FRAMING, ALSO
- ◆ SOME ELECTRICAL WORK

Tel: 01924 513908

Mobile: 07779227945

Are you planning a family B-B-Q?

IMWS offers a hire of built-in B-B-Q which is adequate for a large family in a secluded picturesque environment.

This is a brand new service for the local community.

The offer includes**:

- Two purpose built B-B-Q side by side with encased warmer trays
- Sitting facility for ladies/family members in the conservatory
- Picturesque surrounding
- Complete seclusion and privacy
- Car parking facility



All this for only £20 for 3 hours*

*Taxes not include the cost of other accessories.
Hire will be responsible for any damage to the BBQ.

** Usual terms and conditions apply

Maximum 30 people

Please contact IMWS office on:
(01924) 500555 to secure the booking
or email us on:

info@imws.org.uk

Al-Hikmah Centre, 28 Track Road, Batley WF17 7AA



Al-Hikmah

Where your special day becomes a cherished memory

Weddings

Parties

Functions

Events



Separate Halls for Men and Women with Independent access and each with its own Prayer Facilities - Private Car Park with car park attendants
Easy access, great location - Accommodates 1500 guests - Open Network WiFi

For booking or more details call:

01924 500 555

Or email: info@imws.org.uk

IMWS

[Imws Al Hikmah](#) [@Imws1](#) www.imws.org.uk

CHANGING LIVES THROUGH CLOTHING DONATIONS



SINCE 1993



BANGLADESH

MICRO-FINANCE SOLUTIONS

IRAQ

EDUCATION

KENYA

EAST AFRICA
EMERGENCY RESPONSE

DISASTER PREPAREDNESS

HEALTH & NUTRITION

KOSOVO

MICRO-FINANCE SOLUTIONS

LEBANON

RAMADAN FOOD
DISTRIBUTION

MYANMAR

FOOD ASSISTANCE

PAKISTAN

HEALTH SERVICES

SOMALIA & ETHIOPIA

EAST AFRICA
EMERGENCY RESPONSE

SRI LANKA

ORPHAN
SPONSORSHIP

YEMEN

RAIN CAPTURE SYSTEMS

ORPHAN SERVICES

AFGHANISTAN

ALBANIA

ETHIOPIA

INDONESIA

KENYA

KOSOVO

MALI

NIGER

SOMALIA

SUDAN

YEMEN

TOGETHER WE CAN DO MORE

Are you a graduate looking for your first job?

Want help to step into your career?

We're here to help!

Careers Support Group

The IMWS Careers Support Group run by volunteers want to help graduates with that first step into the career you have chosen.

Free confidential service

Support with CV writing

Support with job applications

Support with interview preparation from both male & female experienced working professionals

Career coaching

Feedback from professionals

Professional skills including role-play and group exercises

Unbiased/ non-judgmental advice

**To access this FREE support or if you are a professional wanting to join this community initiative email:
careers.support@imws.org.uk**

IMWS